

Y
2
1
6
8

શ્રી અશોપિષયાધિ

દેન ગંથમાળા।

દાદાસાહેબ, લાલભાગ.

ફોન : ૦૨૯૮-૨૪૨૫૩૨૨

૩૦૦૧૮૫


દાદ્વીજ મહારાજ

શ્રાહંરશ્રીજ મહારાજ.

પ્રકાશક:—

કૃતાશાની પોળના નવા ઉપાશ્રયનો।

શ્રી સંઘ ————— રાજનગર



વિ. સં. ૨૦૧૩



આવृત્તિ ૧ લી ૨૦૦૦

મુખ્ય-ગુરુભાઈ

અધ્યાત્માલાભકૃતાનુભવાનિષા

નાનારી દુદી કાલાદુદી

પ્રા(મ)

। શ્રીગુરવે નમઃ ।

પૂર્ણ સાંદ્વિલ મહારાજ

શ્રીહીરશ્રીજ મહારાજ.

ખ

પ્રકાશક-નવાઉપાશ્રયના સંઘ તરફથી

શા. સારાભાઈ જેશીગભાઈ

ડ. ઇતારાની પ્રદીપ

અમદાવાદ



આચંતિ ૧ લી]

વિ. સં. ૨૦૧૩

[નિકલ ૨૦૦૦

મૂલ્ય સદુપયોગ.

गुरुभक्ति प्रणिधानाष्टकम् ।

“याऽप्रमत्ता सदा साधु—साध्वा चारविभूषिता ।
 यां द्रष्टुमीहतेऽद्यापि, मनोऽस्माकमतृप्तिगम् ॥ १ ॥
 यथा कृताः कृतार्थाः स्मः, सर्वदा गुणपोषतः ।
 यस्या ऋणं महभित्यं, धार्यते स्माऽस्मदादिभिः ॥२॥
 यस्या विनिर्गताः काम—क्रोधाद्या आन्तरा द्विषः ।
 यस्याः कीर्तिर्यशश्वारु, भासते गगनाङ्गणे ॥ ३ ॥
 यस्यां स्थितं मनोऽस्माकं, नान्यत्र लभते रतिम् ।
 मङ्गलनामधेया सा, गुरुर्नैऽवतु हीरश्रीः ॥ ४ ॥
 ताम् भजामः सदा प्रीता—मनन्यवत्सलं गुरुम् ।
 तयाऽशीर्वादिता नित्यं, सर्वत्र शममाप्नुमः ॥ ५ ॥
 तस्यै नमः सदानन्ददायिन्यै भव्यप्राणिनाम् ।
 तस्या विनिर्गता सद्वाग्, हृदि स्थैर्यं करोतु नः ॥६॥
 तस्याश्रणसेवायाः, प्राप्तिमाशास्महे वयम् ।
 तस्यां पुण्यं पवित्राया—मात्मस्नानं भवेच्च नः ॥७॥
 इति स्तुते गुरो ! दद्याः, सङ्किं जिनशासने ।
 यथा नित्यं वयं हीर--श्रियोऽवियोगमाप्नुमः ॥८॥”

“एवं स्तुता चरणधर्मददा वदान्या,
 शिष्यादिनाऽश्रितजनेन परप्रमोदात् ।
 स्वर्गेऽपि सा स्थितवती शरणप्रदात्री
 सर्वस्य हीरगुरुस्तु शुभं विधात्री ॥९॥”

**भुद्रक : छत्रखाल पुरुषात्भद्रास पटेख : श्री उत्कृष्ट भुद्रखालय
 गांधीराइ, पुल नीचे-अभद्रावाह**

શ્રી અદ્યાત્મ મહાભાગ

શ્રી અદ્યાત્મ મહાભાગ



રા. પુ. મહાભાગ

રા. પુ. મહાભાગ



સુરગ્રાસ્થ પ્ર. સાંદ્રીજ મહારાજ



શ્રી સુધર્માજ મહારાજ

साध्वी श्रीहीरश्री॥

परमेष्ठिपदं नत्वा—अस्माकं गुरोर्नमस्तुतिम् ।

कुर्मस्तदुपकारांशा—अलेखनद्वारसंश्रयात् ॥ १ ॥

हीरश्रीरिति विख्याता, पवित्रा संयमेन या ।

रत्नत्रितयदात्री च, तस्याः शरणमाभवम् ॥ २ ॥

भवेद्यस्माद्द्वितं यस्य, तस्य पूज्यतमः स तु ।

ब्रुवतामिति विज्ञाना—मिदं नानुचितं हृदि ॥३॥

यया मात्रेव वात्सल्या—छालिताः पालिताः सदा ।

शिक्षिता ज्ञानक्रियाभ्याम्, तस्या ब्रूमः कियद्वयम् ॥४॥

तथापि पूज्यस्तोत्रेण, स्तोता गुणी भवेदिति ।

न्यायादनुभूतं, श्रुतं, किञ्चित्स्वार्थाय चिन्महे ॥ ५ ॥

भावार्थ—श्रीअरिहन्तादि पंचपरमेष्ठियोना चरण्यमां नमस्कार करीने अमारां गुड्झीने पण्य तेओआे करेला उपकारोनो अंश भात्र अहीं लभवा द्वारा अमे नमस्कार करीआे छीआे. (१)

‘जेनाथी जेनुं हित थाय ते तेनो अधिक पूज्य गण्याय’ अमे उपदेश आपनारा विद्वानेना हृदयमां अमारं आ अर्थ अनुचित नहि गण्याय, (कारणु के तेओआे उपकारीआना गुणु गावानो उपदेश कयो छे, खीज अज

‘जेनाथी जेनुं हित थाय ते तेनो अधिक पूज्य गण्याय’ अमे उपदेश आपनारा विद्वानेना हृदयमां अमारं आ अर्थ अनुचित नहि गण्याय, (कारणु के तेओआे उपकारीआना गुणु गावानो उपदेश कयो छे, खीज अज

આત્માઓને ઉચિત લાગે કે ન લાગે તેનું અમારે કંઈ પ્રયોજન નથી). (૩)

જેણે માતાની જેમ સહેલ વાત્સલ્યથી અમારું લાદન-પાદન કર્યું છે અને સમ્યગ્ જ્ઞાન તથા કિયાનું શિક્ષણ આપ્યું છે (મોક્ષમાર્ગ આપ્યો છે) તે પરમોપકારી ગુરુનું અમે કેટલું વર્ણન કરી શકીએ ? (૪)

‘તો પણ પૂજયોની સુતિથી સ્તોત્રા શુણી બને છે’ એ ન્યાયથી અમારા હિતને માટે અમે જે અનુભવ્યું અને સાંભળ્યું છે તેને (પુનઃ પુનઃ સ્મરણ કરવાના ઉદ્દેશથી) કંઈક માત્ર અહીં લેખ રૂપે એકહું (સંબંધિત) કરીએ છીએ. (૫)

૨૧૦ ગુરુણી શ્રીચન્દ્રનશ્રીજી.

અહીં જે અમારાં ગુરુણીને અંગે લખવાનું છે તેઓનાં દાદી ગુરુણીજી પૂજય શ્રીચન્દ્રનશ્રીજી મહારાજ હતાં, ઉત્તમ આત્માઓને ઉત્તમ ગુરુઓનો કેવો સુન્દર ચોગ મળે છે તે જાણવા માટે તેઓને અંગે પણ જે અદ્યમાત્ર જાણવામાં આવ્યું છે તે અહીં નોંધી અમે કંઈક માત્ર કૃતજ્ઞતા અનુભવીએ છીએ.

અમદાવાદ (રાજનગર)ના રાયપુર વિલાગમાં ‘આકારોડના કુવાવાળી પોળ’ નામે પ્રસિદ્ધ પોળમાં ધર્મનિષ્ઠ શોઠ વરણિવનદાસ આશારામ નામે ઉત્તમ શ્રાવક રહેતા હતા, તેઓનું કુદુર્ભાઈ ‘અરીદીઆ’ અટકથી આજે પણ પ્રસિદ્ધ છે. તેઓને સુરીલા જ્યાકેરબાધ નામે ધર્મશીલ પત્ની હતાં. વ્યવહાર કૌશલ્ય, કુલીનતા,

ધર્મના આચારોનું યथાશક્ત પાલન, વિગેરે ગૃહસ્થ
 જીવનના શાખુગારથી ભૂષિત તે દૃપતીને સુખ પૂર્વક કાળ
 નિર્ગમન કરતાં વિ. સં. ૧૬૧૧ના પોષ સુદ ૨ ના દિવસે એક
 ગુંગ્રીનો જન્મ થયો. અને તેનું નામ ચન્દ્રનઘેન રાજ્યું.
 આલ્યચેષ્ટા રૂપે પણ બાલકના શુષ્ણો બહુધા તેના ભૂત
 અને ભાવિ જીવનના સૂચક હોય છે. નહાની વયથી જ
 પ્રસન્નચિત્ત, હસમુખ બહેરો, ધર્મનો આદર, વડીલો પ્રત્યે
 વિનય, કદ્યાગરો સ્વભાવ, વિગેરે પૂર્વલવની આરાધનાનાં
 લક્ષ્ણો તેમનામાં પ્રગટ હેખાતાં હતાં. જીવને ઉત્તમ જીવ-
 નની શરૂઆત કોઈ લવમાં શરૂ થાય છે, પછી જે આગામી
 લવોમાં અનુકૂળ સામચ્ચીનો ચોગ મળતો રહે તો ઉત્તરે-
 તર વિકાસ પામતાં તે પરાકાણાએ પહોંચે છે, પણ એવી
 સામચ્ચી અતિહુર્લબ હોય છે. કદાચ મળી જય તો પણ
 તેને સફળ કરવી અતિ હુષ્ટર હોય છે. ચન્દ્રનઘેનના
 શુષ્ણો માતા-પિતાદિના સ્નેહરાગનું નિમિત્ત બન્યા અને
 અનાદિ સંસ્કારના બણે માતાપિતા તેઓને સંસારના
 સુખથી સુખી કરવા મનોરથ કરવા લાગ્યાં. માણેકચોકની
 આઙ્ખુમાં આવેલી ક્ષેત્રપાળની પોળના રહીશ વિશાળ
 કુદુર્ભી મેતા મનસુખરામના પુત્ર ચુનીલાલ સાથે ચન્દ્રન-
 ઘેનનું વેવિશાળ કરી ધણ્ણા મનોરથાને સેવતાં માતાપિ-
 તાએ મંગળ મહોત્સવપૂર્વક તેઓનું લમ પણ કરી
 નાખ્યું. આ ચુનીલાલભાઈ એ જ આજે વિદ્યમાન શતાધિક-
 વર્ષાચું સંધસ્થવિર પરમોપકારી હીર્ધતપસ્વી પ્રશાન્તમૂર્તિં
આચાર્ય ભણારાજ શ્રીવિજયસિદ્ધસૂરીશ્રી ૨૭

મહારાજ. લગ્ન કરતાં માતાપિતાને કચાં ખખર હતી કે અમારાં સંતાનો ભાવિ અલૌકિક જીવન જીવી અનેકનાં ઉપકારક ખનવાનાં છે? લગ્ન થઈ ગયું, પણ ભાવિ જીવન-કળાને વિકસાવવામાં સંસારનાં એ અનધનો ખનને વિદ્ધન-ભૂત જણાયાં. માતાપિતાની આજાને વશ લગ્નનાં અનધનથી જોડાવા છતાં એમને એ માર્ગ ન રૂચ્યો. અને લસ ચુવાવસ્થામાં સંયમ સ્વીકારવાની ભાવનાએ અંકુરિત થઈ.

તે કાળે સાધુએની સંઘ્યા અદ્ય હતી, દીક્ષાનાં માન અને મહત્વ અનેરાં હતાં, શ્રીમૂજયોની (જતિએની) સત્તાનીએ દ્વારાએલેં સમાજ થોડા કાળ પૂર્વે જ કંઈક છૂટકારેં મેળવી શક્યો હતો. અને એ કારણે થોડા માત્ર સંવેગી સાધુએ સમાજમાં આગળ આવી શક્યા હતા.

મનુષ્યને તે કાળે પોતાની જવાખદારીનું-કર્ત્વબ્ય-પથનું સારું લાન હતું, એથી મોટે લાગે જવાખદારી-લયો જીવનનો સ્વીકાર કરતાં પહેલાં સો ગળણે ગળીને પાણી પીવાની જેમ તે બહુ પર્યાલોચન કરતો, પોતાના ખળાખળનો. વિચાર કરી શકય જવાખદારીને ઉઠાવતો, કારણું કે જવાખદાર જીવન જીવનારાએને તે કાળે લોકો મહાન માનતા અને એની આજાને ઉઠાવવામાં ગૌરવનો અનુભવ કરતા. એમ પણ કહી શકાય કે આવી ઉત્તમ પ્રકૃતિને ચોગે સમાજ દીક્ષિત થનારને ખૂબ કસી જોતો, વૈરાગ્યની પરીક્ષામાં પાસ થયા પછી તેને સાથ આપતો, દીક્ષા લીધા પછી તેને વિકાસ માટેની સંઘળી સગવડ.

કરી આપતો અને સંયમથી પડી જવા જેવા પ્રસંગને આવવા પણ નહિ હેતો.

એક ખાજુ માતાપિતા સંબન્ધીઓનો સ્નેહરાગ, ખીજ ખાજુ સમાજની આવી સ્થિતિ, ઈત્યાહિ કારણોથી ચુનીલાલ અને ચન્દનઘેનની લાવનાને ગ્રેત્સાહન આપનાર કોઈ ન હતું, આપ મેળે જ એ લાવનાને પોષી દદ બનાવવાની હતી, છતાં બન્ને સાત્ત્વિક આત્માઓ નાહિભૂત ન થયા, સમયની રાહ જેતા વૈરાગ્યને પોષવા લાગ્યા. ગ્રારમ્ભમાં ચન્દનઘેનનો વૈરાગ્ય તેવો દદ ન હતો, છતાં પતિના વૈરાગ્યે તેઓને ખળ આગ્યું. વીશ વર્ષ જેવી ઈન્દ્રિયોના ઉનમાદાવણી ઉભરમાં લોગો ઉપર કાખૂ મેળવી અધ્યાર્યનું પાલન શરૂ કર્યું, પોતાના પતિને એ રીતે અનુકૂળ બનેલાં ચન્દનઘેને ખરેખર ! ‘પોતાના સ્વીધર્મને શોભાવ્યો’ એમ કહી શકાય. લગ્ન કરવું કે સામાને પોતાની ઈચ્છાઓને આધીન બનાવવો એ દાખ્યત્ય જીવનનું લક્ષણ નથી. કિન્તુ પરસ્પર એક ખીજની ઈચ્છાઓને આધીન બની સહાયારો પાળવાપળાવવામાં સહાયક થવું એ જ ખરે દાખ્યત્ય ધર્મ છે, એમ સમજતાં ચન્દનઘેન તો પતિની ઈચ્છાને આધીન બની તેમના માર્ગમાં સહાયક થયાં, પણ સ્નેહરાગથી બંધાયેલા સ્વજનોએ દીક્ષાની અનુમતિ ન આપી. આખરે ચુનીલાલ-લાઈ સત્ત્વ કેળવી વિ૦ સં૦ ૧૯૭૪ના જેઠ વહી ૨ ના દિવસે દીક્ષિત થયા અને ચન્દનઘેનને એ માર્ગ જવાની સગવડ આપતા ગયા, તો પણ સંબન્ધીઓના સ્નેહથી સંકળાયેલાં ચન્દનઘેન પાંચ વર્ષ વધુ ગૃહસ્થજીવનમાં રહ્યાં અને વિ૦ સં૦

૧૯૩૬ ના ફાગણ સુદ ઉ ના દિવસે સ્વજનોની સમ્મતિ-
પૂર્વક તે પણ દીક્ષિત થયાં.

સંસારી સ્વજનાહિનાં બન્ધનો તોડવાં કેટલાં હુંકર
છે, એ બન્ધનોની પાછળ અનાહિ મોહની વાસનાઓનું
કેવું બળ હોય છે અને એક સત્ત્વશાળી આત્મા તેનો
વિજય કરે છે ત્યારે કેટલાઓને ગ્રેરણ મળે છે, વિગેર
ધાણું તાત્ત્વિક રહસ્ય એમાં ધૂપાએલું હોય છે એને વિરલા
જ સમજ શકે છે, મોટા ભાગનો માનવગણું તો સહૈવ
તેનાથી અજ્ઞાત જ રહે છે. ચુનીલાલભાઈની દીક્ષા વખતે
૬૬ વિરોધ કરનારે પણ સ્વજનાહિ વર્ગ પાછળથી ચન્દ્રન-
હેનની દીક્ષામાં સાથ આપી શક્યો એ પ્રભાવ પૂરુષ મુનિ શ્રી-
સિદ્ધિવિજયજીના દ્વારા વૈરાગ્યનો અને સત્ત્વનો હતો એમ
અતિશયોક્તિ વિના કહી શકાય, એટલું જ નહિ તે પછી
તો કુલીન આત્માઓની કુલીનતા અગ્રકી ઉડી. પુત્રીની દીક્ષા
પછી માતા જ્યકેારફહેનને પણ સંસારની અસારતાનો
ખ્યાલ આવ્યો, તેઓએ પણ દીક્ષા લીધી અને માતા-પુત્રી
સાધ્વીજીવનમાં અનુકૂળ ગુરુણી-શિષ્યા બન્યાં. માતાની દીક્ષા
પાછળથી થવા છતાં ડહેલાના ઉપાશ્ર્યે બિરાજમાન તે કાળે
વિઘમાન પૂરો પંચ મહારાજ શ્રીરતનવિજયજી ગણીના હાથે
વડી દીક્ષા બન્નેની સાથે થઈ, તેમાં માતાનું નામ
સાધ્વીજી જ્યકેારશ્રી રાખી ચન્દ્રનહેન તેમનાં શિષ્યા
સાધ્વીજી ચન્દ્રનશ્રી બન્યાં. કેટલાક વખત પછી ચન્દ્રન-
હેનના ગૃહસ્થભાઈ પણ પૂરુષ મુનિરાજ શ્રીસિદ્ધિવિજયજીના
હુસ્તે દીક્ષા લઈ તેઓના જ શિષ્ય મુનિ શ્રીપ્રમેદ-
વિજયજી થયા. કેવું સૌલાય !

શુરૂણીની (માતાની) સેવાનો લાભ સાઠ ચન્દનશ્રીને એ જ વર્ષ મહ્યો, એ વર્ષના ટુંકા દીક્ષા પયોયમાં આરાધના કરી સાઠ જીથકોરશ્રીજી કાળધર્મ પામ્યાં અને સાઠ ચન્દનશ્રીજી સંયમની સાધનામાં સહાયક વિનાનાં ખની ગયાં. ‘ગીતાર્થને પણ શુરૂકુળવાસ વિના સંયમની આરાધના થતી નથી’ એમ સમજતાં સાઠ ચન્દનશ્રીજીએ ચોંચ્ય નિશ્રાની શોધ કરતાં તે કાળે અમદાવાદ પાંજરાપોળના શ્રાવિકાઓના ઉપાશ્રે બિરાજમાન શામ-દ્વારિ શુરૂણોથી ભૂષિત સાધીજી શ્રીશિવશ્રીજીનાં શુરૂખહેન સાધીજી શ્રીહેતશ્રીજીની નિશ્રાની સ્વીકારી. તેઓની પાસે રહી પોતાના ચારિત્રની ઉત્તમ આરાધના માટે વિનય વૈયાવચ્ચ આદિ અલ્યન્તર અને ખાદ્ય તપની યથાશક્ય સાધના કરતાં તેઓએ પ્રકરણો, કર્મઅન્થ, લાઘ્ય, સંશ્રહણી આહિનો સારે બોધ મેળવ્યો.

તે કાળે સંસ્કૃત પ્રાકૃત વિગેરે ભાષાશાનનો ઓક ઓછો હતો, છતાં સંયમ સાધક ચરણ-કરણ સિત્તરીના બોધનો અને પાલનનો મહિમા વધારે હતો. વર્તમાનમાં જાનયોગ વિકાસને પામ્યો છે, પણ ચરણ કરણાનુયોગમાં શૈથિત્યનો પ્રવેશ વધતો જાય છે તેને બદલે તે કાળે જાનયોગની મન્દતા હતી છતાં ચરણકરણાનુયોગનું બળ સારું હતું, તે કાળે જાનીએ હુર્લબ હતા તેમ વર્તમાનમાં દદનિર્મણ આચાર હુર્લબ થતો જાય છે. કાળને યોગે આવાં પરાવર્તનો અનાદિ કાળથી થયા જ કરે છે, તેને સમજુને જે કાળે જે હુર્લબ-હુર્લકર હોય તેની રક્ષામાં વધારે સત્ત્વ

કેળવવિં જોઈએ. કોરા જ્ઞાનથી કે માત્ર કિયાથી નહિ, પણ ઉલયના સુમેળથી સ્વ-પર હિત સાધી શકાય છે.

જ્ઞાનાભ્યાસ, વિનય, વૈયાવચ્ચ, ત્યાગ, તપ, વિગેરે ગુણોથી સાધના કરતાં સાધ્વીજી ચન્દ્રનાનાનાને પૂરો સાધ્વીજી જ્ઞાનશ્રીજી પ્રથમ શિષ્યા થયાં. તેઓની પછી અનુકૂળે સાધ્વીજી અરોકશ્રીજી, સારો સુભદ્રાશ્રીજી, સારો ચતુરશ્રીજી, પંજાથી સાધ્વી રામશ્રીજી, સારો શ્રીજિનશ્રીજી અને સારો સુવતાશ્રીજી વિગેરે શિષ્યાઓ થયાં.

સંયમનો રાગ, અઠપ્રવચન માતાઓનું પાલન, પ્રતિજ્ઞાની અર્દ્ધા, જવાખદારીનું ભાન અને શિષ્યાઓને સંયમની શિક્ષા આપવી, વિગેરે તેમના વિશિષ્ટ ગુણો હતા. તેઓનાં પરિચિત આજે પણ જે જે વિદ્યમાન છે તેઓ તેમના ગુણોની પ્રશંસા કરે છે. અમારાં સ્વરો પૂજય ગુરૂણીજી હીરશ્રીજી મહારાજમાં જે કોઈ ગુણો અમારા અનુભવમાં આજ્યા છે તે તેઓએ પોતાનાં હાથી ગુરૂ આ શ્રીચન્દ્રનાનાની સોણ વર્ષ પર્યાન્ત અખણડ અન્તિમ વૈયાવચ્ચ કરી હતી તેની કૃપાનું પરિણામ હતું એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી. ‘ચો઱્ય ગુરૂની એવા ઉત્તમ શિષ્યને કદ્વપવૃક્ષની જેમ ક્રણે છે’ એ સાચું જ છે. ગુરૂના ગુણો અને આશીર્વાદના બળે શિષ્ય પોતાની સાધના કરી શકે છે.

એમ કુલ ૪૩ વર્ષોં ચારિત્ર પાળી મોટા પરિવારને પાછળ મૂકી પૂરો સારો શ્રીચન્દ્રનાનાને વિંસ્ટો ૧૯૮૨ ના અષાડ વહ ૭ ના રોજ કાલધર્મ પાભ્યાં, આજે પણ તેમના પરિવારમાં આશરે ૩૦૦ સાધ્વીઓ વિચરે છે.

૨૧૦ ગુરુણી શ્રીઅશોકશ્રીજી.

ઉપયુક્ત દાદી ગુરુણીજી શ્રીચન્દનશ્રીજીનાં ખીજ નમ્ભરનાં શિષ્યા સ્વો સાધ્વીજી શ્રીઅશોકશ્રીજી મહારાજ, એ અમારાં સ્વો ગુરુણી શ્રીહીરશ્રીજી મહારાજનાં ગુરુણી હતાં. સાઠ ચન્દનશ્રીજી દેશકાળને અનુસરી વિહાર કરતાં વિં સં ૧૬૫૭ની સાલમાં સુરત પથાર્યાં, ત્યાં ગોપીપુરા વિલાગના હજુરાન મહોલ્લામાં જવેરી ગ્રેમચંદલાઈનામે ધર્મ-શ્રીમન્ત અને ગર્ભશ્રીમન્ત આવક રહેતા હતા, તેઓનાં સુપુત્રી લક્ષ્મીખણેને ૫૦ ચન્દનશ્રી મહારાજના પરિચયથી સંસારની અસારતાનો ખ્યાલ આવતાં તેઓ સંયમ સ્વીકારવા ઉત્સાહિત થયાં અને વિં સં ૧૬૫૭ ના વૈશાખ વદ ૬ ના દિવસે તે કાળે ત્યાં વિરાજમાન ૫૦ મુનિરાજ શ્રીસિદ્ધિ-વિજયજી (વર્તમાનમાં ૫૦ દાદા શ્રીવિજયસિદ્ધિ-સૂરીશ્વરજી) મહારાજને હાથે તેઓએ પ્રવન્નયા અંગીકાર કરી. તેઓનું નામ સાધ્વીજી શ્રીઅશોકશ્રીજી રાખી સાધ્વીજી શ્રીચન્દનશ્રીજીનાં શિષ્યા બનાવ્યાં. તે પછી સુરતમાં જ છાણીનાં રહીશ હીરાકુંવર અને સુરતની છાપરીયાશેરીનાં રહીશ ખણેન કાખુખણેને દીક્ષા આપી અનુક્રમે સાઠ શ્રીહીરશ્રીજી અને સાઠ શ્રીકલ્યાણશ્રીજી નામ રાખી તે અન્નેને ૫૦ સાઠ શ્રીઅશોકશ્રીજીનાં શિષ્યા બનાવ્યાં. એમાં સાઠ શ્રીહીરશ્રીજી એ જ અમારાં સ્વો ગુરુણી હતાં.

સાઠ શ્રીઅશોકશ્રીજી એક ગર્ભશ્રીમન્ત કુલીન માતા-પિતાનાં પુત્રી હતાં, એટલે ભાવ્યકાળથી જ તેઓનું જીવન અક્ષુદ્ર વિગેરે શુણોથી ભૂષિત હતું. ઉત્તમ ક્ષેત્રમાં જન્મ,

જાતાપિતાના જીવનની વિશિષ્ટતા, શ્રીમન્તાઇ અને ઉત્તમ કુળાચારો, વિગેરે પુણ્ય સામથી માનવતાની સાધના ઉપરાન્ત આત્માના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે, એવી સામથીથી જીવને ઉદ્ધાર સ્વભાવ ધડાય છે અને પરિણામે એ બાધ્ય ઉદ્ધારતા હૃદયની વિશાળતાને સર્જને અનેક કર્ડવા મીઠા પ્રસંગોમાંથી સમતાપૂર્વક પસાર થવાનું બળ પ્રગટાવે છે, એના પરિણામે ખીજાઓ પ્રત્યે વાત્સલ્યલાવ પ્રગટે છે અને સ્વ—પર ઉપકારમાં સફુળ થઈ શકાય છે. માટે તો વિપુલ જીવન સામથીને આપનારા પુણ્યની પણ ઉપાદેયતા માની છે. આત્માની ચોઝ્યતા અને પુણ્યસામથીનો ચોગ એથી પવિત્ર બનતો જીવ પુણ્યને લોગવવા છતાં તેનાથી પર રહી આખર પુણ્યથી પણ પાર થઈ શકે છે. આ હક્કિકત સાઠ અશોકશ્રીજીમાં પ્રગટ દેખાતી હતી, રાજવૈલવ જેવી સુખ સામથીમાં ઉછરવા છતાં સંયમ માટેની તૈયારી, તેનો સ્વીકાર અને યથાશક્ય સંયમના પાલન ઉપરાન્ત જ્ઞાનાદિ શુણોની પ્રાપ્તિ માટેનો અપ્રમાદ, વિગેરે ઉત્તમ શુણોને તેઓ પ્રગટ કરી શકયાં હતાં. કુલ ૩૧ વર્ષ ચારિત્રપાલન કરી વિંઠ સં ૦ ૧૯૮૮ના આસો. સુ. ૭ ના હિવસે સુરત છાપરીયાશોરીમાં તેઓ કાળધર્મ પાભ્યાં હતાં. પોતાની મુખ્ય શિષ્યાને હાથી શુરૂણીની સેવામાં રાખી પોતે સાઠ શ્રીકલ્યાણશ્રીજી સાથે રહેતાં હતાં. એમના જીવનના પણ અનેક પ્રસંગો અનુકરણીય હતા. સાઠ શ્રીકલ્યાણશ્રીજીએ પણ અન્તકાળ સુધી તેમની અખણ્ડ સેવા કરી હતી અને આજે પણ તેઓ પર્યાયવૃદ્ધ છતાં લઘુતા કેળવીને સહુને સંભાળવામાં જાગ્રત છે.

૪૦ સ્વ૦ ગુરૂણી શ્રીહીરશ્રીજ મહારાજ.

અમારાં નિકટનાં ઉપકારી સ્વ૦ ગુરૂણી શ્રીહીરશ્રીજ છે, તેઓના ઉપકારનું ઝણું અનેક લવોની સેવાથી પણ ચુકવી શકાય તેમ નથી, છતાં તેઓના જીવનની સમૃતિ માટે કંઈક માત્ર લખી આત્મ સંતોષ અનુભવવા અમારો આ પ્રયાસ છે.

ઉપર તેઓનાં હાહી ગુરૂણી શ્રીચન્દ્રશ્રીજ મહારાજ અને ગુરૂણી શ્રીઅશોકશ્રીજ મહારાજ હતાં એમ જણાયું.

તેઓનો જન્મ વિંઠ સં ૦ ૧૯૨૭ ના કારતક વદ ૧ના રોજ છાયાપુરી (છાણી) ગામમાં થયો હતો. છાણી ગામ નાનું છે, શહેરોના જેવી ત્યાં જીવનસામન્ધી નથી, વડોદરાની દક્ષિણ દિશામાં ચારેક માધીલ ફૂર એ ગામમાં શ્રાવકોનાં આશરે ૮૦ ઘરો છે, છતાં ત્યાંની ધર્મસામન્ધી અને ધર્મની આરાધના એક શહેરથી પણ પ્રમાણુમાં વધી જાય તેવી આકર્ષક અને પવિત્ર છે, ત્યાં સોળમા તીર્થાંકર અને પાંચમા ચડેપત્તી શ્રીશાન્તિનાથ ભગવાનના આકર્ષક આશરે ૪૫ ઈચ્છિના મૂળનાયકના બિમખથી વિભૂષિત શ્રીબ્રિજિનમનિદ્ર એક તીર્થની ગરજ સારે તેવું છે. આનુમાં જ લય ઉપાશ્રય, સામે સુશોલિત અને જૈનાગમોના સંબ્રહથી ભરપૂર જૈન શાનમનિદ્ર છે. વીશમી સહીના શાસનના નાયક સમા કેટલાય આચાર્યાદિ મુનિવરોનાં અને અનેક સાધ્વી ગણુનાં ત્યાં ચાતુર્માસ થયેલાં છે. એટલું જ નહિ, એવા ઉત્તમ દેવ-ગુરુના યોગને સક્રમ

કરતા આશરે ૧૭ જેટલા પુરુષોએ અને આશરે ૫૦ જેટલી બહેનોએ છેલ્લા ૫૦ વર્ષોમાં પરમ પારમેશ્વરી હીક્ષાને અંગીકાર કરી સ્વ પર જીવનને ધન્ય બનાવ્યું છે. માત્ર ૮૦ જેટલા ધરોમાંથી આટલા આત્માઓ સંયમને સ્વીકારે એ આ ચુગમાં આશ્ર્ય ઉપજવે તેથું જ નહિ, કિન્તુ સંસારના રસીયાને પણ અનુમોદના ઉપજવે તેથું છે, આ ધર્મની છાયા પામેલા છાયાપુરી ગામમાં ધર્મનિષ્ઠ શ્રાવક કીલાચન્હલાઈ અને શ્રાવિકા જડાવખણનાં તેઓ પુત્રી હતાં. એ બહેનો અને એક લાઈ એમ ત્રણમાં તેઓ વડીલ હતાં, તેઓનું નામ હીરાકુંવર બહેન હતું. નામ પણ નામ માત્ર ન હતું, પણ ગુણવાચક હતું, એમ કહી શકાય. કારણ કે હીરાની જેમ ધરમાં સહુને તે અતિપ્રિય હતાં તેમ બાલ્યકાળથી સ્વભાવે જ તે કાળના માનવ સમૂહમાં હીરાની જેમ વૈરાજ્યના તેજથી તેજસ્વી હતાં. પૂર્વ-ભવની આરાધનાના સંરક્ષાર અને એના પરિણામે આ લવમાં મળેલી ઉત્તમ ધર્મસામચ્ચી, અન્નેના બેણે નાની ઉત્તમરથી જ તેમને દેવ-ગુરુ-ધર્મનો રાગ સારો હતો. સમયને અનુસાર વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરતાં સ્વીજીવનને અનુરૂપ ધરનાં કામકાજની કળાઓમાં પણ પ્રવીણ બન્યાં. પછી તેઓ યૌવન વય પાર્યાં લ્યારે હુન્યવી વ્યવહારોમાં આસક્ત માતાપિતાએ તેમના જીવનને સંસારના પ્રવાહમાં દોયું.

એ કાળે જીવનમાં મર્યાદાઓનું મહત્વ હતું, એથી સંતાનો ધર્મછાએ કે અનિચ્છાએ માતાપિતાની ધર્માને માન

આપતાં, વડીલોની ઈચ્છાથી વિરુદ્ધ વર્તોવ તે કાળે એક મોટા હૃષણ તરીકે મનાતો, એથી વૈરાગી પણ આત્માઓ માતાપિતાદિની ઈચ્છાને આધીન ખની સંસારના માર્ગ ચઢી જતા.

હીરાકુંવર માટે પણ ગ્રાયઃ એવું જ બન્યું. કાવી અને ગન્ધારની વચ્ચે આવેલા જગ્ભૂસર નામના શહેરમાં પ્રતિષ્ઠાવન્તા શેડ પાનાચન્દભાઈ અને તેમનાં ધર્મપત્ની ગંગાબેન રહેતાં હતાં, તેઓને પુરુષોત્તમદાસ, મોહનલાલ અને બાલુભાઈ નામે ત્રણ પુત્રો ઉપરાન્ત આદિતી નામે એક પુત્રી હતાં. વ્યવહાર અને કુલાચારથી પ્રધાન એ કુદુર્ભમાં પુરુષોત્તમદાસની સાથે ફેન હીરાકુંવરનું વેવિશાળ કરી માતાપિતાએ જાણે પોતાને માયેથી ઋણ ઉતારબું હોય તેમ તેમનું લજ પણ કરી નાખ્યું. હીરાકુંવર ફેન કુમારિકા મટીને ગૃહિણી બન્યાં, પણ તેઓનું ચિત્ત એમાં માન્યું નહિં. ધનાઢ્ય ધરમાં લોગની વિપુલ સામની પણ તેમને આકર્ષી શકી નહિં, બદકે વૈરાગ્ય દઢ થતો ગયો. પરિણામે સંયમ ન લેવાય ત્યાં સુધી છ વિગાધઓનો સામાન્ય રૂપે ત્યાગ કરી પોતાની સંયમની ભાવના પ્રગટ કરી. લર્યૌવનમાં સાંસારિક સુખોના મનોરથો સેવતા પુરુષોત્તમભાઈ તો ન પીગળ્યા, પણ તેમનાં માતાપિતા કે સાસુ-સસરાને પણ તેની અસર થધ નહિં. એમ છતાં સત્ત્વ કેળવી હીરા-કુંવર ફેન પોતાના માર્ગ અડગ રહ્યાં. એમ સેણ વર્ષ જેટલો લાંબો કાળ વહી ગયો, તે ગાળામાં પોતાના એ હીથરો પૈકી નહાના હીથર મોહનભાઈમાં વૈરાગ્યનો રંગ પૂરી તેઓને

સંયમના અર્થી ખનાવ્યા અને ચૌદ વર્ષની નહાની ઉમરમાં વિંઠ સંં ૧૯૬૭ ના મહા વ પના રોજ તે કાળે પંઠ શ્રીઆનનદસાગરજી ગાણિવર (સાગરાનનદસૂરીક્ષરજી) પાસે દીક્ષા અપાવી. વર્તમાનમાં તેઓ તેમના પદ્ધતર શ્રીમાણુ-કસાગરસૂરિજી તેઓના સમૃદ્ધાયના મુખ્ય આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે.

હીરાકુંવર હણેનનો પોતાનો આત્મા પણ સંયમ માટે ઉત્કષીદિત થતો ગયો અને આખરે છેલ્લા છ મહિનાઓમાં મૂળથી સર્વ વિગાધાનો ત્યાગ કરી શીશ્ર સંયમ સ્વીકારવાનો દદ સંકદ્ય કરી લીધો. ગૃહસ્થજીવન દરમ્યાન કરેલી જિનલક્ષ્ણા, ચુડલક્ષ્ણા અને ધર્મક્ષિયાઓએ તેમના આત્માને વૈરાગ્યના રંગથી રંગી દીધો અને વડીલોની સમૃતિ હુર્લાલ માની સ્વયં સંયમ લેવા તૈયાર થયાં. વિંઠ સંં ૧૯૬૭ના જેઠ વદ દ ના મંગળ પ્રભાતે સુરતની પાસે જલાલપુર જવા માટે ઘેરથી નીકલતાં શુલ શકુનાદિ ઉત્તમ નિમિત્તો મળતાં તેમનો ઉત્સાહ વધી ગયો અને ત્યાં જઈ શ્રીશાન્તિનાથ પ્રલુની છેલ્લી દ્રવ્ય પૂજાલક્ષ્ણા આદિ માંગલિક કરી સ્વયમેવ સાધ્વીનો વેશ ધારણ કરી લીધો.

છાણી અને જમ્બૂસર સમાચાર પહેંચી ગયા, પુરુષોત્તમદાસ તુર્તી ત્યાં પહેંચ્યા અને કરવા ચોઝ્ય શક્ય પ્રયત્નો કર્યો છતાં ત્યાંના સંઘની સમજવટથી અને હીરાકુંવર હણેનના દદ નિશ્ચયથી આખરે મન શાન્ત કરી તેઓ યાછા જમ્બૂસર ગયા.

હૃરાકુંવર ખેનને આ એક બન્ધન હતું તે તૂરી ગયું અને સંયમનો પન્થ નિષ્કષ્ટક થયો. તે પ્રસંગે વર્તમાનમાં સાઠ કલ્યાણશ્રીજી કે જેઓ ગૃહસ્થ હતાં તેઓએ સુન્દર સહાય કરી હતી. તે પછી સુરતના જવેરી જવેરચંદ્ભાઈનાં સુપુત્રી રતનખેન કે જેઓ હાલ તેઓનાં જ શિષ્યા સાઠ શ્રી સુમિત્રાશ્રીજી તરીકે વિઘ્નમાન છે તેઓની સાથે પાદ્યારી વિહાર કરી તેઓ સુરત ગયાં. તે અવસરે ત્યાં ચાતુર્માસ માટે પધારેલા શ્રીસાગરાનંદ સૂરીશ્વરજી બિરાજતા હતા, તેઓને મળી સઘળી હક્કિકત જણાવી અને તેઓશ્રીએ વિં સં ૧૯૬૭ના અષાડ સુદ ૧૧ના રોજ હૃરાકુંવર ખેનને વિધિપૂર્વક દીક્ષાની કિયા કરાવી જવન્નજીવ સુધીનું સામાયિક ઉભ્યરાવી સાઠ શ્રીચન્હનશ્રીજીનાં શિષ્યા સાઠ શ્રીઅશોકશ્રીજીનાં શિષ્યા સાઠ શ્રીહૃરશ્રીજી નામ સ્થાપન કર્યું. એમ ગૃહસ્થાશ્રમનાં બન્ધન તોડી ત્યાગી બનેલાં હૃરાકુંવર ખેનની ઈચ્છા લગભગ વીશ વર્ષે પૂર્ણ થઈ એનો આતનંદ તેમના ઉત્સાહનો પોષક બન્યો. વડી દીક્ષા ન થાય અને ગુરુણી પાસે ન પહોંચાય ત્યાં સુધી યોગ નિશ્ચા માટે પૂર્ણ સાગરાનંદ-સૂરીશ્વરજીએ તેમને સુરતમાં વિચરતાં યોગ (જેગ)શ્રી નામનાં સાધ્વીને સોંઘ્યાં. ચાતુર્માસ દરમ્યાન ત્યાં રહી વિનય વૈયાવચ્ચ જ્ઞાન ધ્યાન આદિમાં દત્તચિત્ત બનેલાં સાઠ શ્રીહૃરશ્રીજીએ સાઠ જેગશ્રી પાસેથી સાધુ જવનનું પ્રાથમિક જ્ઞાન મેળ્યું.

ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરુણીની પાસે જવા સુરતથી

વિહાર કરી છાણી (છાયાપુરી કે ને) પોતાની જનમભૂમિ છે ત્યાં) ગયાં. તેમનાં ગુરુણી વિગેરે સાધ્વીગણુ પણ ત્યાં પધારેલો હતો અને ૫૦ પન્થાસળ મહારાજ શ્રીસિદ્ધિવિજયજી ગણી (વર્તમાનમાં ૫૦ દાદા શ્રીસિદ્ધિસ્કુરીશ્વરજી) પણ લર્દ્યનું ચાતુર્માસ પૂર્ણ થતાં છાણી પધાર્યો હતા, તેઓની પાસે ચોગોદ્રહનાંદિ કરી લીધું અને વિંઠ અંઠ ૧૯૬૮ના મહા સુદ ૧૦ ના રોજ તેઓશ્રીના મુખે મહાત્મતો ઉચ્ચરી (વડી દીક્ષા સ્વીકારી) પોતાના આત્માને કૃતાર્થ કર્યો (વધુ જવાખદારીવાળો બનાવ્યો). દીક્ષા વખતે જે સંખન્ધીએ સાથ ન આપી શક્યા તે વડીદીક્ષા વખતે પૂર્ણ સહાયક થયા અને તેઓના ગૃહસ્થ પિતાશ્રી કુલાચંદ્રભાઈએ નૂતન દીક્ષાની જેમ ઘણું આડમ્બરપૂર્વક ગામ બહાર વટવૃક્ષની નીચે ૫૦ ગુરુદેવને હાથે વડીદીક્ષા અપાવરાવી. એક કાળે જે અનુચ્ચિત જણાતું હતું તે પણ આખરે સહુને ચોગ્ય જણાયું. પોતે મોહાધીન બની આટલાં વધો અન્તરાયભૂત બન્યા તેનો પક્ષાત્તાપ થયો અને છેલ્દે છેલ્દે પણ સહુએ તેઓની દીક્ષાની ખૂબ ખૂબ અનુમોદના કરી. ગુરુણી અને દાદી ગુરુણી વિગેરેની નિશ્ચામાં સંયમનું પાલન કરતાં ગુણુનો પ્રકર્ષ થતો ગયો. તેઓનો સંયમનો આદર અને પુણ્યબળ કેવું હતું તે જાણવા માટે તેમણે સ્વ-પર કરેલી આરાધના ઉપરાન્ત બહાળો શિષ્યાઓનો પરિવાર એ મોહું પ્રમાણ છે. તેઓએ સંયમ લીધું ત્યારથી યથાશક્ય વિહાર કરી જુદા જુદા પ્રદેશોમાં

ચાતુર્માસો કર્યાં, એટલું જ નહિ, પણ જ્યાં જ્યાં વિચચ્છાં
 ત્યાં પોતાના ચારિત્રની છાયાથી દોકેને આકર્ષણું કર્યાં,
 ઘણું આત્માચોને ધર્મમાં જોડ્યા અને પ્રાય: દરવર્ષે એકાનેક
 હળેનોને દીક્ષાચો આપી સંયમી ખનાવ્યાં. સુમારે ૪૩
 વર્ષ જેટલા દીક્ષા પર્યાયમાં લગલગ શિષ્યા પ્રશિષ્યાદિ કુલ
 અઠીસો જેટલાં સાધ્વીચોનાં તે શુરૂણું ખન્યાં હતાં. દીક્ષાચો
 આપવા માટે જ આપી ન હતી. પણ સમય અને
 શક્યતાને અનુસારે દરેકને જ્ઞાન અને કિયામાં પૂર્ણ સહાય
 કરી તેઓનું આત્મહિત સાધવાનું તેઓનું સુખ્ય લક્ષ્ય હતું
 અને તેમાં તેઓ સમયાનુસાર સફળ પણ થયાં હતાં,
 દીક્ષિતોમાં મોટો વર્ગ કુલીન, લોગ સામની સર્પન્ન,
 સ્વજન વર્ગને પ્રિય અને સુશિક્ષિત છે, તેમ ઘણો ભાગ
 આલઘ્રાહયારિણીચોનો છે.

તેઓના જ્ઞાનમાં ત્યાગ વૈરાગ્ય સાહજિક ગ્રગટેલા
 હતા, જીંહા ઉપર સારો કાણૂ હતો, ભાષામાં મધુરતા
 હતી, અપ્રમાદ પણ તેવો જ હતો અને આશ્રિત વર્ગ
 પ્રત્યેનું વાત્સલ્ય પણ આદર્શરૂપ હતું. થોડા પણ ઉપ-
 કારને તેઓ ભૂલતાં ન હતાં, લધુતા એક શાણુગાર હતો
 અને એ બધું હોવા સાથે ઉદ્ધારતા અદ્ભૂત હતી, લાવ
 ઔદ્ઘાર્ય પણ અનુકરણીય હતું, ન્હાની વાતને પણ
 સમજ શકતાં છતાં કરવા યોગ્યની ઉપેક્ષા પણ કરી
 શકતાં હતાં. ઉપરાન્ત શુણુનુરાગથી હૈયું હુમેશાં
 પ્રસન્ન રહેતું, પૂજયવર્ગ પ્રત્યે પૂજયભાવ અને વિનયાદિ
 પણ તેવાં જ સુન્દર હતાં, ન્હાનામાં ન્હાના સાધુ પ્રત્યે

પૂજયલાવ ધરાવતાં હતાં, જ્ઞાન પ્રત્યેનો આદર, જિનાજ્ઞાનો રાગ, વ્યાખ્યાન સાંભળવાનો પ્રેમ, વિગેરે ખીલઓને પણ પ્રેરણું આપે તેવાં હતાં અને પુણ્ય પ્રક્રષ્ટ પણ અદ્ભૂત હતો. દરેક ગુણોનો પૂર્ણ ખ્યાલ તો શી રીતે આપી શકાય ? પ્રત્યક્ષ જેઅલા પણ ભાવો દેખનમાં ઉતારી શકાતા નથી, એ તો અનુભવથી જ સમજાય, તો પણ કંઈક માત્ર અહીં સંશોધ કરીએ છીએ.

ત્યાગ વૈરાગ્ય—ઉલય કુદુર્ભમાં લર્યો પાથર્યં લોગોની વિપુલ સામની છતાં ભરયૌવન વયથી સંયમની અભિલાષા, સોણ સોણ વર્ષ સુધી છ (કાચી) વિગઈઓનો ત્યાગ અને પ્રક્ષયર્થનું પાતન કરવાપૂર્વક ગૃહસ્થાશ્રમ—નો નિર્વાહ કરવો, વિગેરે તેઓનો ત્યાગ ગૃહસ્થાલુવનથી જ વૈરાગ્ય મૂલક હતો. સંયમ લુવનમાં પણ એ ગુણ અધિકાધિક ખીલતો જ રહ્યો હતો, અને ઔપયારિક નહિ રહેતાં નૈષિક (નૈસર્જિક) બની ગયો હતો. માટે જ અનેકાનેક લુવોને તેઓ સંયમ માર્ગે જેડી શકાયાં હતાં. તેમનો થાડો વખત પરિચય કરનારા પણ યોગ્ય લુવો સંયમ પ્રત્યે સન્માનવાળા બની જતા, તેમાંના કેટલાકે તો સંયમ પણ લીધું છે.

રસનાનો વિજય શેષ ઇન્દ્રિઓના વિજયથી અતિ હુષ્કર ગણેલો છે, તેનો કાખું પણ તેમણે ઢીક કેળવ્યો હતો. દશ દ્રવ્યથી કોઈ દિવસ વધારે દ્રવ્યો નહિ વાપરવાં એવો તેમનો અસિશોહ હતો. દશમાં પણ ઓછામાં ઓછું એક તો છોડલું, કોઈ દિવસે દશ પુરાં વપરાય તો ખીજે

દ્વિસે આડ જ વાપરવાં, એ નિયમનું છેક સુધી પાલન કર્યું હતું. દીક્ષાદિનથી વીશ વર્ષ એકાસણ્ણાથી ઓછો તપ કર્યો ન હતો, તેમાં પણ દશતિથિ તો આયમ્બિલ ઉપવાસથી ઓછું નહિ. છેક ખાલ્યવયથી આરમ્ભેલી નવપદની શાશ્વતી ઓળિની આરાધના છેક છેલવા વર્ષ સુધી ચાલુ રાખી હતી. વર્ધમાન તપની પણ ૧૭ ઓળિઓ કરી હતી. અટ્ઠાઈનો તપ પણ તેઓએ કર્યો હતો, વિગઈએ પણ પ્રમાણુભૂત જ લેતાં, અનેક જાતની વસ્તુઓ મળવા છતાં આ ચુગમાં આ રીતે તેમણે સાચવેલો રસનાનો કાણું સહજ પ્રશંસા માગી લે છે. એમના આ ગુણુની છાયાથી આશ્રિતવર્ગ પણ વિના ગેરણ્ણાએ તેમને અનુસરવા યથાશક્ય જાયત રહેતો. અનેક જીવોના કલ્યાણુની જવાબદારી માટે તેમનો આ ગુણ તેમને સારો સાથીદાર બન્યો હતો.

ભાષામાં મધુરતા ઉપરાન્ત દઢતા અને સત્ત્વ પણ હતાં. પ્રાય: આદેયં નામકર્મના ઉદ્યને લીધે તેઓનું વચન કોઈ ઉથાપતું નહિ, વર્ષો સુધી સેંકડો સાધ્વીઓને સમલાણવા છતાં તેઓ પ્રત્યે એક પણ સાધ્વીને અસફલાવ થવાનો પ્રસંગ બન્યો નથી, હરેક તેમની સેવામાં રહેવા દૃચ્છતાં, હિતશિક્ષા સાંભળતાં અને બુદ્ધાં વિચરતાં વિરહનું હુઃખ અનુભવતાં, એ એમની મધુર પ્રિય અને હિતકર વાણીનો મહિમા હતો.

આગ્રમાદ અનુકરણીય હતો, કિયામાં જગૃતિ હતી, ઉલય રાધમ બનતાં સુધી ઉલાં ઉલાં પ્રતિકમણ કરતાં, નિરાખરિમિત હતી, પાછલી રાત્રે વહેલા જાયત થઈ દરરોજ

જખિમણુઠલનો પાઠ, ચહિસરણુ, આઉર પચ્ચકુખાણુ, પંચસૂત્ર-માંતું પ્રથમ પાપપ્રતિધાત શુષ્ટુભીજિનધાનસૂત્ર, નવરમરણ, ગૌતમાષ્ટક, વિગેરે માંગલિક પાઠ કરતાં, જાન વિગેરેના કાચોાત્સર્ગો, નવકારવાળીથી જાપ, દરરોજ હજાર ઉપરાન્ત ગાથાએનો સ્વાધ્યાય, બાંધી નવકારવાળીથી નમસ્કાર મહા-મન્ત્રનો જાપ, વિગેરે તેમનું નિત્યકર્મ હતું. શક્તિ પહેંચી ત્યાં સુધી દરરોજ જાનનાં પ, નવપદનાં એ અને શત્રુંઝયનાં ૨૧, ખમાસમહોંસ ઉલાં ઉલાં હેતાં, માંદગીનાં છેલ્લાં એ વર્ષ સ્વયં ન કરી શક્યાં ત્યારે અન્ય સાધ્વી મુખે સાંસ-ળીને પણ એ આરાધના અતૂટ રાખી હતી.

વાતસલ્ય અદ્ભૂત હતું. એના પ્રતાપે કોઈ તેમના વચનનો અનાદર કરતું નહિ, મોટાથી નહાના સુધી દરેક પ્રત્યે વિવેક પૂર્વક સમલાવ ધરાવતાં, પોતે ઉપવાસી હોય તો પણ પારણે અન્ય સાધ્વીએને વપરાવીને (સાથે રાખીને) પછી જ વાપરતાં. સારી વસ્તુ વાતસલ્યભાવે બીજાને આપવામાં તેમને અધિક આનન્દ થતો. પ્રસંગે બીજાને જાન-ધ્યાનમાં સગવડ આપવા કોઈ કોઈ કાર્ય પોતાની જતે કરી લેતાં, કઠોર વચન પણ વાતસલ્યથી મીઠું અને આદેય બની જતું. ‘જીવ માત્રને કર્મના ઉદ્ય અનુસાર રૂચિની લિન્નતા હોય છે’ એમ સમજી દરેકની રૂચિને વાળવા (સુધારવા) કોરીષ કરતાં પણ વિરોધ કરતાં નહિ ‘ઈચ્છકાર’ સામાચારીનું શક્ય પાલન કરતાં, એ જ કારણ હતું કે સહુના પ્રત્યે તેઓના હૃદયમાં માતાથી પણ અધિક વાતસલ્ય હતું.

કૃતજ્ઞતા સુનદર હતી, ગૃહસ્� જીવનમાં પોતાને અન્તરાય કરનાર પણ માતાપિતાદિ સ્વજનો પ્રત્યે તેમને અદ્વયમાત્ર બેરાળ ન હતી, બદકે તેમના ઉપકારને ચાદ કરતાં. પૂર્ણ આચાર્ય મહારાજ શ્રીસાગરાનન્દસુરિલાલે કાચી દીક્ષા આપી જે આશ્રય આપેલો તેનાં તે ભારોભાર ઝણું હતાં, એથી જ તેઓ પ્રત્યે તેમને સાંચ માન અને પૂજયભાવ હતો. સિવાય સાધ્વી જીવનમાં પણ પોતાને જેનાથી જેનાથી લાલ થયો હતો તેનું વારંવાર સ્મરણ કરતાં અને એ ગુણું કેળવવા અમને વારંવાર પ્રેરણું કરતાં. જે ઉપકારીને પણ સમજ-ઓળખી શકે નહિ તે અપકારી-ઓને પણ ક્ષમા કરવા જેવો કે ઉદ્ધરવા જેવો વીતરાગનો માર્ગ કદ્દી પણ આરાધી શકે નહિ, માટે કૃતજ્ઞ અનવાની તે ખાસ લલામણ કરતાં.

લઘુતા અપૂર્વ હતી, ખસો જેટલાં શિષ્યાચોનાં ગુરુણું છતાં માન. તેમને નહયું ન હતું. વ્યવહારને બાધ ન આવે તેમ અન્ય સાધ્વીગણની સાથે વતોવ કરતાં. બિમારી જેવા પ્રસંગે કે કારણે વિહારાદિકમાં ખીલાં સાધ્વીની સેવા કરવા પણ ઉત્સાહ ધરાવતાં. અન્ય સાધ્વીઓ પ્રત્યે વિનયાદિ ઔચિત્યને ખરાખર સાચવતાં.

ઉદારતા એવી હતી કે પોતાની કોઈ પણ વસ્તુ ચોંચ આત્માને સંયમમાં ઉપકારક કેમ બને તેનું પૂર્ણ લક્ષ્ય રાખી વસ્તુ, પાત્ર, પુસ્તક કે ખીલું જે ખીલને આપી શકાય તેટલો તે વધારે આનન્દ માનતાં. બાહ્ય વસ્તુની જેમ અભ્યન્તર ઔદ્ઘાર્ય પણ વિશિષ્ટ હતું અને

એથી ભૂત થયે શિક્ષા કરતાં તેમ અચોજ્યની ઉપેક્ષા પણ કરી શકતાં. એથી જ આગહ કે હુરાગહથી તે અચી ગયાં હતાં અને સર્વનો ગ્રેમ જીતી શકયાં હતાં.

ગુણાનુરાગ એવો હતો કે નિન્દા તો કદી તેમના મુખે થતી જ નહિ. સ્વ કે પર સમુદ્દરના પણ ઉત્તમ આત્માઓના ગુણને આગળ કરી અમોને તેવું અનુકરણ કરવાને સમજવતાં, જ્ઞાન પ્રત્યેનો રાગ એવો હતો કે લણનારને જેઠ તેઓ પુલકિત થઈ જતાં, પોતાના સાધ્વી-જીઓને અધ્યયન કરાવવા તે ખૂબ કાળજી ધરાવતાં, રાત્રે જગે ત્યારે ઉંઘેલાને જગાડી પાઠ કરવા એસાડતાં, વૃદ્ધાવસ્થામાં પણ બાળકની જેમ પોતે ગોખતાં, લણુતાં, ભૂત શ્રતાં ખીલને પૂછતાં સંકોચ ધરતાં નહિ, અમે જે કંઈ શૈંકું પણ જ્ઞાન મેળવી શકયાં તે તેઓની કાળજીનું પરિણામ હતું, તેઓની ઈચ્છા સાધ્વીઓને કાયમી લણવાની સગવડ કરી આપવાની તીવ્ર હતી, અમારા ભાગ્યે શૈંકું વધારે જીવ્યાં હોત તો એ સગવડ પણ જરૂર તેઓ કરી શકયાં હોત. પોતાને સંસ્કૃત પ્રાકૃત ભાષાઓનો સામાન્ય એધ હતો, છતાં ખીલં સારો અભ્યાસ કરી ચોઝ્ય બને એ માટેની તેમની લાગણ્ણી કદી ન ભૂલાય તેવી હતી. આજે પણ તેમના એ ગુણને અમો જેટલો યાદ કરીએ તેટલો આછો છે.

વિનય વૈયાવચ્ચ તરફ તેમનો પક્ષપાત હતો, કારણ કે વડીલો પ્રત્યે પૂજ્યભાવ અદ્ભૂત હતો, એથા પોતાની ક્ષતિઓને અંગે ગુર્વાહિ તરફથી ઠપકો મળતાં કે

શિક્ષા થતાં તેઓ નારાજ નહિ થતાં, ઉપકાર માનતાં.
ચોતાના અતિ ઉપકારી અનન્ય શરણ તુલ્ય પૂજય પ્રાતઃ
સમરણીય દાદા શ્રી વિજયસિદ્ધિસ્તૂરીશ્વરજીની કૃપાને અખણ્ડ
રાખવા તે સહૈવ જાગ્રત હતાં.

જિનાજ્ઞાનો રાગ એવો હતો કે નહાની મોટી કોઈ
પણ પ્રવૃત્તિ પાછળ વીતરાગની આજા વિરુદ્ધ કંઈ પણ ન
થઈ જય તેની કાળજી રાખતાં, માટે જ કિયામાં વિધિનો
આદર હતો, અને સહુને અવિધિથી બચાવવા સારણા-વારણાદિ
કરવામાં સહૈવ જાગ્રત હતાં. વ્યાખ્યાન સાંલળવામાં ખૂબ
આદર હતો એમાં પણ સારા વ્યાખ્યાતાનો ચોગ હોય
ત્યારે તો શરીરની સ્વસ્થતાની પણ ઉપેક્ષા કરતાં. જિન-
વાણી ન હોય તો આ જગતનું શું થાય ? એ તેઓ સમ-
જતાં હતાં અને પ્રત્યેક ભવમાં એનો ચોગ આત્માને ફુર્લલ
હોવાથી એ વિષયમાં સારો આદર ધરાવતાં હતાં.

પુષ્ય પ્રકુર્ષ અદ્ભૂત હતો. શ્રીમન્તો અને સત્તા-
ધીશો પ્રત્યે પણ તેમના પુષ્યની છાયા પડતી. મેવાડમાં
રાજગઢ પાસે એ માઇલ દૂર વિધર્મિએ દરવર્ષે પંચેન્દ્રિયનું
(પાડાનું) દેવીને બલીદાન આપતા, તે તેઓએ સામાન્ય
ઉપરેશ કરતાં પણ બન્ધ થઈ ગયું હતું; સર્વત્ર માન સન્માન
પામતાં. વિના પ્રયત્ને શાસનનો ઉધોત થાય તેવું તેઓનું
પુષ્ય પ્રલાવક હતું, અતિપરિચ્યમાં આવતા આત્માએ
પણ અવજાને બદલે આદર ધરાવતા, રાજનગરમાં જ્યારે
જ્યારે રહ્યાં ત્યારે પ્રાયઃ એક જ ઉપાશ્રયમાં રહેવા છતાં
અને પર્વતિથિ આરાધનાને અંગે સંઘમાં મતલેદ હોવા

છતાં તેઓની તરફ કોઈને અનાદર ન હતો. એમ પુણ્યની વિરોધતા છતાં તેઓ એ સધળો શાસનનો કે વીતરાગે પ્રરૂપેલા ચરિત્રધર્મનો મહિમા સમજતાં અને પોતાના આત્માને એ ગૌરવના ભારથી બચાવી લેતાં.

વિહાર ચાતુર્માસ અને દીક્ષાએ પણ અનુમોદનીય છે. પહેલું ચાતુર્માસ સંં ૧૯૬૭નું સુરત કરી છાણી ગયાં ત્યાં વડીદીક્ષા વિગેરે થયા પછી ગુરુણી વર્ગની સાથે સંં ૧૯૬૮નું ચાતુર્માસ છાયાપુરી જ કર્યું, ત્યાં મૂળ પેથાપુરનાં વતની પાર્વતી પહેન કે જે પોતાના મોસાળ છાયાપુરીમાં રહેતાં હતાં તેમણે પૂઠ ગુરુણીના પરિચયથી સંયમ લેવા ધર્યા કરી અને વિં સંં ૧૯૬૯માં ૫૦ પૂઠ આચાર્ય (તે કાળે પંન્યાસ) શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજીના વરદ હસ્તે દીક્ષા આપી, પ્રથમ શિષ્યા સાઠ શ્રી પ્રધાનશ્રીજી બનાવ્યાં. વિં સંં ૧૯૬૯નું ચાતુર્માસ વડોદરા કર્યું. ત્યાંથી વિહાર કરી વિં સંં ૧૯૭૦ માં ભર્ય ચાતુર્માસ કરી સુરત તરફ વિહાર કર્યો, ત્યાં છાપરીયા શોરીનાં વતની કાણુંપહેનની દીક્ષા પોતાના ગુરુણીના નામની થર્ધ, નામ સાધ્વીજી શ્રીકલ્યાળુશ્રીજી રાખ્યું તેઓશ્રી સ્વલાવે શાન્ત સરળ અને લઘુતા ગુણુધારક છે. તેઓએ ગુરુણીજી શ્રીઅશોકશ્રીજી મહારાજની વૈયાવચ્ચમાં રહી અન્ત સુધી શુરૂસેવાનો પૂર્ણ લાલ લીધો હતો, આજે પણ અમારાં ૫૦ ગુરુણીના વિરહમાં અમારા દરેક પ્રત્યે ગુરુણી જેટલું મમત્વ રાખી વાતસલ્યભાવે સહેવ માર્ગદર્શન આપે છે અને પોતે પણ યથાશક્ય આરાધનામાં રહે છે.

પૂરો શુરૂણીજી વિઠો સંઠો ૧૯૭૧નું ચાતુર્માસ સુરત
કરી સંઠો ૧૯૭૨માં લર્દું ગયાં ત્યાં મહુધાવાળાં ચંચળ-
પહેન અને છાણીવાળાં જડાવપહેનને દીક્ષાએ અપાવી,
બન્નેનાં અનુક્રમે સાઠો દાનશ્રીજી અને હરખશ્રી નામ
રાખી પોતાનાં શિષ્યાએ કર્યાં. ત્યાંથી વિહાર કરી સીનોાર
ગયાં, સંઠો ૧૯૭૨નું ચાતુર્માસ ત્યાં રહ્યાં. ચાતુર્માસ પછી
વિહાર કરી છાણી ગયાં, ત્યાં કપડવણુજનાં વતની ચંચળ-
પહેનને દીક્ષા અપાવી પોતાનાં પ્ર=શિષ્યા સાઠો દમયન્તી-
શ્રી બનાવ્યાં, ત્યાંથી વિહાર કરી અમદાવાદ પદ્ધાર્યાં
ચાતુર્માસ સંઠો ૧૯૭૩નું અમદાવાદ કર્યું અને ત્યાં
અમદાવાદ કાલુપુર વિલાગની કડીયાની પોળનાં રહીશ
શ્રીઓ ચંચળપહેનને દદ વૈરાગ્ય થતાં વિઠો સંઠો ૧૯૭૪માં
પતિપત્નીની સાથે દીક્ષાએ થઈ પતિ સુશ્રાવક મણીલાલ
પૂરો આચાર્ય મહારાજ વિજયસિદ્ધિસૂરીશ્વરજીની નિશ્રામાં
ચારિત્ર સ્વીકારી સુનિશ્ચી મહોદય વિજયજી (વર્ત્માનમાં)
આચાર્ય શ્રીવિજયમનોહરસૂરીશ્વરજીના પ્રથમ શિષ્ય થયા
અને ચંચળપહેનનું નામ સાધ્વીશ્રી સુનનદાશ્રીજી રાખી
શુરૂણીશ્રી હીરશ્રીજીનાં શિષ્યા કર્યાં. સાણુંદરી વિહાર કરી
પાટણ ગયાં, વિઠો સંઠો ૧૯૭૪નું ચાતુર્માસ પાટણ કર્યું,
ત્યાંથી છાણી તરફ વિહાર કરી સંઠો ૧૯૭૫નું ચાતુર્માસ
છાણીમાં કર્યું. ત્યાંથી વિહાર કરી વઢવાણ પદ્ધાર્યાં અને
ત્યાં ઉંઘાવાળા મણીપહેનને તથા ભીલીમોરાવાળાં હરકોર-
પહેનને દીક્ષાએ અપાવી પોતાનાં શિષ્યાએ અનુક્રમે
સાઠો રેવતીશ્રી અને સાઠો હેમશ્રીજી કર્યાં ત્યાંથી વિહાર

કરી છનીઆર ગયાં અને ૧૯૭૬માં ચાતુર્માસ ત્યાં રહ્યાં. ત્યાંથી વિહાર કરી અમહાવાદ ગયાં, ત્યાં શ્રાંતિ શક્રોળેનને દીક્ષા અપાવી પોતાનાં શિષ્યા કરી સાઠ શાન્તિશ્રી નામ આપ્યું. ચોમાસું પણ વિઠ સં ૦ ૧૯૭૭નું ત્યાં જ પૂર્ણ કર્યું. વિહાર કરતાં વિઠ સં ૦ ૧૯૭૮માં ઘમડાચાનાં વતની પાલીળેન, અમહાવાદ ધાંચીની પોળનાં રહીશ સમરતળેન તથા ધુસાપારેખની પોળનાં જસુદળેન અને પછીળેન, એમ ચારને દીક્ષાઓ આપી અનુક્રમે પ્રથોધશ્રીજી, સંજમશ્રીજી, સુશીલાશ્રીજી અને પદ્માશ્રી નામ આપ્યાં. સં ૦ ૧૯૭૮નું ચાતુર્માસ પુનઃ ત્યાં જ કર્યું, ચાતુર્માસ પછી વિચરી પુનઃ સં ૦ ૧૯૭૯નું ચાતુર્માસ અમહાવાદમાં કર્યું. ત્યાંથી વિચરી છાણી ગયાં અને વડોદરાનાં વતની જશકોરળેનને ઉમેટામાં દીક્ષા અપાવી તેમનું નામ સુદર્શનાશ્રી રાપ્યું. ૧૯૮૦નું ચાતુર્માસ છાણીમાં કર્યું અને ૧૯૮૧માં અમહાવાદ ચાતુર્માસ માટે પદ્ધાર્યોં. ચોમાસા પછી વિહાર કરી પાલીતાણું પદ્ધાર્યોં, ત્યાં છરી પાળતાં નવાણું યાત્રાથી શ્રી ગિરિરાજની આરાધના કરી, પુનઃ અમહાવાદ પદ્ધાર્યોં, ત્યાંનાં રહીશ હીરાળેનને દીક્ષા આપી સાઠ વસ્તનાશ્રીજી નામ રાપ્યું. સં ૦ ૧૯૮૨માં પણ ચાતુર્માસ અમહાવાદ કર્યું. ચાતુર્માસ પછી ત્યાં શામળાની પોળવાળાં લલિતાળેનને, વાધણુ-પોળવાળાં લીલાળેનને, વીરમગામવાળાં ચન્દનાળેનને, ઝૂતાશાની પોળવાળાં માણેકળેનને, ઐતરપાળની પોળવાળાં કુમળાળેનને, પાટણુંનાં રહીશ વિજયાળેનને, ધાંચીની

પોળવાળાં કુલ્લીણહેનને અને અવેરી પોળનાં રહીશ જાસુદ
હહેં તથા લીલાણહેનને, એમ કુલ ૯ દીક્ષાઓ આપી
અનુક્રમે સાઠ સુમતિશ્રીજી, દર્શનશ્રીજી, ચારિત-
શ્રીજી, પ્રજ્ઞાશ્રીજી, કુસુદશ્રીજી, વિનયશ્રીજી, વિદ્યા-
શ્રીજી, લક્ષ્મીશ્રીજી અને જ્યાશ્રીજી નામ રાખ્યાં.
ચાતુર્માસ પણ સં ૧૯૮૮માં અમદાવાદ રહ્યાં. પુનઃ
ચાતુર્માસ પછી અમદાવાદનાં સુલદ્રાણહેનને અને છાણી-
વાળાં ડાહીણહેન તથા ચન્દનણહેનને એમ ત્રણું દીક્ષાઓ
આપી અનુક્રમે સાઠ વલ્લભશ્રીજી, સાઠ દેવશ્રીજી
અને સાઠ ચન્દ્રાશ્રીજી નામ રાખ્યાં. સં ૧૯૮૪માં
પણ ચાતુર્માસ અમદાવાદ રહ્યાં, તે પછી સં ૧૯૮૫નું
ચાતુર્માસ પાલીતાણા કર્યું અને તે વર્ષે ત્યાં છાણીનાં
ચન્દનણહેન તથા કપડવણજનાં મોતીણહેનને દીક્ષાઓ આપી
અનક્રમે સાઠ ચરણશ્રીજી અને સાઠ સુર્ગણશ્રીજી
નામ આપ્યાં. ત્યાંથી વિહાર કરી અમદાવાદ પથાર્યાં અને
સં ૧૯૮૬નું ચાતુર્માસ પણ અમદાવાદ કર્યું. વિ ૦ સં ૧૯૮૭માં
છાણીમાં સાઠ પુણ્યાશ્રીજી, સાઠ સુજ્ઞાન-
શ્રીજી, સાઠ સુમલયાશ્રીજી, અને સાઠ વિદુતશ્રીજી
ને દીક્ષાઓ આપી ચાતુર્માસ પણ છાણી કર્યું. વિ ૦ સં ૧૯૮૮માં
સાઠ સુર્ગણાશ્રીજી, સાઠ સુરેન્દ્રશ્રીજી,
સાઠ સુમિત્રાશ્રીજી, સાઠ કમળશ્રીજી અને સાઠ
ચન્દ્રોદયાશ્રીજીને દીક્ષા આપી, પુનઃ ચાતુર્માસ છાણીમાં
જ રહ્યાં. વિ ૦ સં ૧૯૮૯નું ચાતુર્માસ અમદાવાદ થયું,
તે વર્ષે સાઠ હંસાશ્રીજી, સાઠ સુલોચનાશ્રીજી, સાઠ

ગીર્વાણુશ્રીજી, સાઠ કનકશ્રીજી, સાઠ સુયશાશ્રીજી, સાઠ સૂર્યકાન્તાશ્રીજી તથા સાઠ ચન્દ્રપ્રભાશ્રીજીને દીક્ષાઓ આપી. ત્યાંથી વિહાર કરી વિઠો સંં ૧૬૬૦માં માળવા મેવાડ પ્રદેશમાં વિચરી ચાતુર્માસ રતલામ કર્યું. ચાતુર્માસ પંથી સં. ૧૬૬૧માં સાઠ મનકશ્રીજી, સાઠ મનોહરશ્રીજી, સાઠ વિચકણુશ્રીજી, સાઠ દૈવનદ્રાશ્રીજી અને સાઠ કૈલાસશ્રીજીને દીક્ષાઓ આપી ચાતુર્માસ માળવામાં રાજગઢમાં કર્યું. વિઠો સંં ૧૬૬૨નું ચાતુર્માસ માળવામાં મેતપુર ગામમાં થયું અને તે વર્ષે સાઠ ભિત્રાશ્રીજી અને સાઠ મંજુલાશ્રીજીને દીક્ષાઓ આપી. સં. ૧૬૬૩નું ચાતુર્માસ રતલામ કર્યું અને તે વર્ષે સાઠ મહોદયાશ્રીજીને દીક્ષા આપી. વિઠો સંં ૧૬૬૪નું ચાતુર્માસ પણ પુનઃ રતલામમાં જ કર્યું અને તે વર્ષે સાઠ ચેલ્લાણુશ્રીજી, સાઠ ઉમીલાશ્રીજી, સાઠ રંજનશ્રીજી, સાઠ રાજેન્દ્રધીજી અને સાઠ ત્રિલોચનાશ્રીજીને દીક્ષાઓ આપી. વિઠો સંં ૧૬૬૫માં પુનઃ ગુજરાત બાળુ વિહાર કરી તે સાલનું ચાતુર્માસ અમદાવાદ કર્યું. તે વર્ષે ત્યાં સાઠ સદ્ગુણુશ્રીજી, સાઠ પદ્મલતાશ્રીજી, સાઠ નિરંજનાશ્રીજી, સાઠ સ્નેહલતાશ્રીજી, સાઠ પ્રભાંજનાશ્રીજી, સાઠ કનકપ્રભાશ્રીજી, સાઠ તિલકશ્રીજી, સાઠ અરૂણુશ્રીજી, સાઠ રમણીકભીજી, સાઠ મનોજ્ઞાશ્રીજી, સાઠ સૂર્યમશાશ્રીજી, સાઠ વિજ્ઞાનભીજી, સાઠ ચન્દ્રકળાશ્રીજી સાઠ વિનોદભીજી, સાઠ ભદ્રકરામીજી, અને સાઠ હેમલતાશ્રીજી,

વિગેરને દીક્ષાઓ આપી. સં. ૧૯૬૬નું ચાતુર્માસ અમદાવાદ શહેર ખડાર જૈન સોસાયટીમાં કર્યું. તે વર્ષે ત્યાં સા. ૧૦ તીર્થશ્રીજી, સા. ૧૦ નનદનશ્રીજી, સા. ૧૦ જીતેન્દ્રશ્રીજી અને સા. ૧૦ મહિમાશ્રીજીને દીક્ષાઓ આપી. વિ. ૧૦ સં. ૧૯૬૭નું ચાતુર્માસ પાલીતાણામાં કર્યું અને તે વર્ષે સા. ૧૦ ગ્રિયંકરાશ્રીજી, સા. ૧૦ મલયપ્રલાશ્રીજી, સા. ૧૦ જ્યોત્સ્નાશ્રીજી, સા. ૧૦ કુમળપ્રલાશ્રીજી, સા. ૧૦ ચાર્દલાતાશ્રીજી, સા. ૧૦ કુવલયશ્રીજી, સા. ૧૦ હેમેન્દ્રશ્રીજી અને સા. ૧૦ તૈલોક્યશ્રીજીને દીક્ષાઓ આપી. સં. ૧૯૬૮માં સા. ૧૦ તરુણશ્રીજી, સા. ૧૦ કુતિંપ્રલાશ્રી અને સા. ૧૦ હેમપ્રલાશ્રીજીને દીક્ષાઓ આપી અને ચાતુર્માસ લાવનગરમાં કર્યું. સં. ૧૯૬૯માં ચાતુર્માસ અમદાવાદ કર્યું અને સા. ૧૦ કૌશાલ્યશ્રીજીને તે વર્ષે દીક્ષા આપી. સં. ૨૦૦૦ નું ચાતુર્માસ પ્રષ્ટ અમદાવાદ થયું અને તે સાતમાં સા. ૧૦ ચિદાનન્દશ્રીજીને દીક્ષા આપી. વિ. ૧૦ સં. ૨૦૦૧નું ચાતુર્માસ પણ અમદાવાદ રહ્યાં અને તે વર્ષે સા. ૧૦ પૂર્ણાદ્રાશ્રીજી, સા. ૧૦ ધનંજ્યાશ્રીજી, સા. ૧૦ દીનેન્દ્રશ્રીજી, સા. ૧૦ ધન્દિરાશ્રીજી, સા. ૧૦ રતિપ્રલાશ્રીજી, સા. ૧૦ જ્યોતિંપ્રલાશ્રીજી અને સા. ૧૦ પ્રવીણાશ્રીજીને દીક્ષાઓ આપી સં. ૨૦૦૨માં પણ ચાતુર્માસ અમદાવાદ રહ્યાં અને તે વર્ષમાં સા. ૧૦ જ્યક્ષાશ્રીજી, સા. ૧૦ હિરણ્યશ્રીજી, સા. ૧૦ જ્યલદ્ધમાશ્રીજીને તથા સા. ૧૦ જ્યથવન્તાશ્રીજીને દીક્ષાઓ આપી સં. ૨૦૦૩માં વિહાર કરી ચાતુર્માસ છાઝીમાં કર્યું અને તે વર્ષે સા. ૧૦ દેવાંગનાશ્રીજી, સા. ૧૦ ચન્દ્રધરા-

શ્રીલ, સાં દીવ્યશ્રીલ, સાં રત્નગુણાશ્રીલ, અને સાં શીલગુણાશ્રીલને દીક્ષાઓ આપી. તે પછીનાં સંં ૨૦૦૮ સુધીનાં પણ પાંચ ચોમાસાં વિહાર માટે શરીર અશક્ત અનવાથી છાણીમાંજ કર્યાં અને અનુકૂળે સંં ૨૦૦૪માં સાં હંસપ્રભાશ્રીલ, સાં રત્નપ્રભાશ્રીલ, સાં રવિપ્રભાશ્રીલ, સાં અનુપ્રભાશ્રીલ. સાં વિદ્યુતપ્રભાશ્રીલ, સાં લખિધશ્રીલ, સાં દીવ્યયશાશ્રીલ અને સાં પદ્મયશાશ્રીલને, વિં સંં ૨૦૦૫માં સાં મનોરંજનાશ્રીલ, સાં હિરણ્યપ્રભાશ્રીલ, સાં હર્ષપ્રભાશ્રીલ, સાં પુણ્યલતાશ્રીલ, સાં પદ્મકીર્તિશ્રીલ અને સાં જ્યકીર્તિશ્રીલને દીક્ષાઓ આપી. સંં ૨૦૦૭ માં સાં યરોબદ્રાશ્રીલ સાં સુરપ્રભાશ્રીલ, સાં વિનોતાશ્રીલ સાં વસન્તપ્રભાશ્રીલ, સાં સૂર્યમાલાશ્રીલ, સાં ગુણમાલાશ્રીલ, સાં હર્ષપૂર્ણાશ્રીલ, સાં ભદ્રપૂર્ણાશ્રીલ, સાં જ્યાનનદશ્રીલ, સાં નયાનનદશ્રીલ, સાં રત્નપ્રભાશ્રીલ અને સાં હર્ષકાન્તાશ્રીલને દીક્ષાઓ આપી. વિં સંં ૨૦૦૮માં સાં પૂર્ણાનનદશ્રીલ, સાં મદનરેખાશ્રીલ, સાં રત્નરેખાશ્રીલ અને સાં કીર્તિલતાશ્રીલને દીક્ષાઓ આપી. વિં સંં ૨૦૦૯ માં સાં ધર્મપ્રભાશ્રીલ સાં અર્દ્ધાદ્યાશ્રીલ, સાં ગુણાદ્યાશ્રીલ સાં અર્ક્ષપ્રભાશ્રીલ સાં શુલોદ્યાશ્રીલ, સાં હંસકીર્તિશ્રીલ અને સાં યશકીર્તિશ્રીલને દીક્ષાઓ આપી. એ વર્ષે અમદાવાદના શ્રાવિકા વર્ગના આગ્રહથી અને છેલ્લી અવસ્થામાં અનન્ય ઉપકારી મૂલ્ય

શુરૂમહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને દર્શાન-
વન્દનાં કરવાની ભાવનાથી સાધનક્ષારા અમહાવાહ પદ્ધાર્યાં
અને સંં ૨૦૦૬ તથા સંં ૨૦૧૦નું ખને અન્તિમ
ચાતુર્માસ ત્યાં જ રહ્યાં. વિં સંં ૨૦૧૦માં સાઠ જ્ય-
સેનાશ્રીજી, સાઠ કૃતિસેનાશ્રીજી, સાઠ મહાનનં-
શ્રીજી, સાઠ માર્ગોદયાશ્રીજી અને સા. નિત્યોદયાશ્રી-
જીને દીક્ષાઓ આપી તથા વિં સંં ૨૦૧૧માં સાઠ
જીતસેનાશ્રીજી, સાઠ વિનયજ્ઞાશ્રીજી, સાઠ ચાર્દશી-
લાશ્રીજી, સાઠ ચાર્દધર્માધીજી, સાઠ જ્યપદ્માશ્રીજી,
સાઠ મૃગનયનાશ્રીજી, સાઠ બિન્હુપૂર્ણાશ્રીજી, સાઠ
જ્યપૂર્ણાશ્રીજી, સાઠ શીલપૂર્ણાશ્રીજી સાઠ વિમલયશા-
શ્રીજી સાઠ સુર્યરેખાભાજી તથા સાઠ જ્યરેખાશ્રીજીને
દીક્ષાઓ આપી. એમ તેમની વિદ્યમાનતામાં દીક્ષિત થયેલા
આત્માઓનાં નામ માત્ર અહીં જણાવ્યાં છે. કાલધર્મ પઢી
પણ એ વર્ષમાં આજ સુધી દ્શેક દીક્ષાઓ થઈ છે. આ
ખઘો મહિમા તેઓના પવિત્ર ચરિત્રનો અને પુણ્યપ્રકર્ષનો
જ કહી શકાય. શુરૂશિષ્યાના સંખનથી ઓળખી શકાય
એ ઉદ્દેશથી ચરિત્રની પઢી માત્ર તેમના પરિવારની કોષ્ટકથી
નોંધ લીધી છે તે વાંચતાં કોણુ કોનાં શિષ્યાઓ છે તે
પણ સમજી શકાશે.

ધર્મ આરાધના પણ તેઓએ યથાશક્ય સારી
કરી કરાવી હતી. ઉપરના સાધ્વી પરિવારથી સહજ ખ્યાલ
આવે તેમ છે કે તેઓએ પોતાના જીવન કાળમાં દીક્ષાઓ
આપી હતી તે પ્રમાણમાં અનેક આત્માઓને દેશવિરતિમાં

પણ જોક્યા હતા. નાની મોટી વિવિધ તપશ્ચિર્યાઓ, જ્ઞાન-દાન, સામાન્ય પ્રત નિયમો, વિગેરે પોતાના સાધ્વી જીવનની મર્યાદાને અનુસરતો ઉપકાર કરી અનેક આત્મા-ઓને ધર્મમાં જોક્યા હતા. લક્ષ્યબિન્દુ સહૈવ આત્મ શુદ્ધિનું હોવાથી આશ્રિતોને પણ આન્તરિક કષાયાદિને કાપવાની વારવાર પ્રેરણું કરતાં, નવાં કર્મોન બન્ધાઈ જય તે માટે જાયત રહેતાં અને અશાતાના ઉદ્યમાં પણ કર્મની પરિણુતિને વિચાર કરી સમતામાં જીવતાં.

ઓધ—પ્રકરણો, કર્મઅન્થો, ખૃહત્સંશ્રહશી, ક્ષેત્ર-સમાસ, કુલકો, સંસ્કૃત પ્રાકૃત ભાષાજ્ઞાન, વિગેરે પ્રક્રિષ્ટુક અન્થોનો છતાં સચોટ હતો, વારંવાર પરિશીલન સાથે અનુપ્રેક્ષાની શક્તિ સારી હોવાથી તેમાંથી ભાવોને સમજ દેતાં પોતાના આત્માને ઉપકાર કરે તે જ એધ પોતાનો ગણ્યાય, પરને ઉપકાર કરે તે પારકો ગણ્યાય એવી દફ સમજથી જે જે વાંચતાં વિચારતાં તેને સ્વશક્તિ અનુસાર પોતાના જીવનમાં ઘટાવતાં, યથાશક્ય અમલ પણ કરતાં અને અમને પણ ભણેલું પોતાને ઉપકારક બનાવવાની સતત પ્રેરણું આપતાં. એમની અમારી ઉપરની કૃપાદિષ્ટ અતુલ હતી, એ કારણે વારંવાર અણુમૂલ ડિતશિક્ષાઓ આપ્યા જ કરતાં, એ બધું કેટલું નોંધી શકાય ? એટલું જ પર્યાપ્ત છે કે તેમના ઉપકારને યથાર્થ રૂપે સમજાવવાની અમારામાં શક્તિનો જ અસાવ છે.

છેદ્દી અવસ્થા—વિં સં ૦ ૨૦૧૦નું ચાતુર્માસ પૂર્ણ થયા પછી ઉત્તરોત્તર શરીર અસ્વસ્થ બનતું ગયું અને

છેલ્લે તો બોધી સ્થિર થઈ જતાં અંગ (અવયવો) પણ નિષ્ઠિય બની ગયા. ધીમે ધીમે અસ્ત્રસ્થતા વધતી ગઈ તેમ તેમ લાંખા જીવનની આશાઓ ઘટતી ગઈ. ચૈત્રમાસની ઓળણીની આરાધના પછી કૃષ્ણપક્ષમાં શરીર ખૂબ અશક્ત બન્યું અને શુરુદેવનાં દર્શન કરવા તેઓની ભાવના થઈ, એથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયમનોહરસ્કુરી શ્વરજીને ઉપાશ્રેયે પધારવા વિનિતી કરી. તેઓ કૃપાળુ પધાર્યો ત્યારે તેઓશ્રીના મુખે પુનઃ મહાત્મતોનું ઉચ્ચારણ વિગેરે અન્તિમ કિયા સ્વસ્થતા પૂર્વક કરી સર્વ જીવોને ક્ષમાપના વિગેરે સ્વસ્થ ચિંતે કરી લીધું. તેઓના ઉપકારને યાદ કરી તેમની આરાધના નિમિત્તે શ્રીસંઘે કહેલી ધર્મકરણી પણ અનુમોદનીય હતી. સાધ્વી વર્ગ અને શ્રાવક-શ્રાવિકા વર્ગે ને ધર્મ કરવાનું તેઓને કહ્યું હતું તેની નોંધ નીચે પ્રમાણે છે.

૧૬૬૨ ઉપવાસ.

૪ વર્ષતિપ.

૨૦ વીશસ્થાનકની ઓળણીઓ.

૧૪૬૬ આયંબિલ.

૨૭૩૫ એકાસણ્ણાં.

૪૦૪૫ બેસણ્ણાં.

૩૬ નવપદજીનીઓળણીઓ.

૨૫૦૦ ખાંધીનવકારવાળીથી.
અદીલાખ નવકારનો
ન્યા.

૧૧૦૦૦૦૦ અગ્રિઆર લાખ
નવકારનો જાપ.

૬૮૮૫૦૦૦ અડસઠલાખપંચાશી
હંબર સ્વાધ્યાય.

૧ માસક્ષમણુ.

૩ અદૂધિનો તપ.

૨ છમાસી.

૧ ચોમાસી.

૧ ત્રણ માસી.

૨૦૦૦૦ સામાયિક.

૩ અધીમાસી	૪ નવાળુયાત્રાઓ
૨ દ્વિમાસી	સિદ્ધાચળજીની
૨ હોઠમાસી	૫ શંખેશ્વરલુનીયાત્રાઓ
૧ એકમાસી	૧૧ ગીરનારલુની યાત્રાઓ
૧૦૦ પૌષ્ઠ	૫૦ સિદ્ધગિરિજી આદિની તીર્થ યાત્રાઓ.

એ સિવાય પણ નાનાં મોટાં તીર્થોની યાત્રાઓ, પૂજા પ્રલાવનાઓ, તથા જીવહ્યા વિગેરેમાં દ્રવ્યવ્યય કરવાનું, ઈત્યાદિ ધર્મી આરાધના કહી હતી. આ નોંધથી જણાશે કે આશ્રિત સાધ્વી વર્ગ અને ગૃહસ્થવર્ગ તેઓ પ્રત્યે કેટલો સુનદર સહભાવ ધરાવતો હતો.

એમ સંઘે કહેલા ધર્મની અનુમોદના કરતાં તેઓનો આત્મા વિ૦ સં૦ ૨૦૧૧ના વૈશાખ વદ ૧ના સાંજે લગભગ પાંચને પંચાવન મિનિટે નશ્વર દેહને છોડી ચાહ્યો ગયો, શોકની છાયા પથરાઈ ગઈ, છતાં તેઓએ આપેલી હિતશિક્ષાઓએ અમને એ વિરહને સહન કરવાની પણ શક્તિ આપી અને કરવા ચોઝ્ય વિધિ કરી વોસિરાવ્યા પછી ગૃહસ્થોએ સ્નાનાદિ કરી મૃતકને શાશુગાર્યું.

થીને દિવસે સવારના સાડા આડ વાગતાં તેમની ભવ્ય સમશાન યાત્રા નીકળી, હળરો નરનારીઓ એ પવિત્ર આરાધનાથી પૂજન્ય બનેલા મૃતદેહનું દર્શન કરવા ઉલટ્યાં અને જ્ય જ્ય નનદા-જ્ય જ્ય જ્ય ભદ્રાના પ્રધોષ સાથે રાજનગરના રાજમાર્ગે જતાં હળરો મનુષ્યોની વર્ષે ભૂલતાં એ મૃતકને જોઈ જોઈ અનુમોદના કરી ગયાં.

કાળના અટલ નિયમને કોણું અટકાવી શક્યું છે ? આખ્યાં રે અમારી આશાઓ પણ અધુરી જ રહી અને એ વન્દનીય પૂજનીય હેહને પણ અજિન સંસ્કાર કરી ગૃહસ્થોએ પોતાનો ધર્મ બજાર્યો.

શુરૂણીજુ ગયાં, પણ તેમના ગુણો વિસરે તેમ નથી. અમારી પ્રાર્થના છે કે લવોલવ શ્રી જિનશાસનનાં આરાધક ઉત્તમ એ ગુરુનો અમને ચોગ મળે અને અમે કૃતાર્થ થધાયો.

તેઓના કાળધર્મને ચોગે અનેક સ્થળો ઓચ્છવો મહોત્સવો ઉજવાયા હતા. રાજનગરમાં પણ કૃતાશાની પોળના ચરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રલુના મન્દિરમાં ભવ્ય અદ્ધૂર્ધ મહોત્સવ ખૂબદ્દ સ્નાત સહિત ઉજવાયો હતો.

અમે અને ખીલ પણ ભવ્યજીવો પૂજય ગુરૂણીના ઉપકારોનું અને શુણોનું વારંવાર સમરણ કરી શકીએ એ ઉદેશથી યાદ રહેલું જેની પાસેથી જે જે મલ્યું તે તે મેળવીને અહો લેખ રૂપે સંકલિત કરાયું છે. ભવ્ય આત્મનાઓ તેને વાંચી વિચારી યથાશક્ય લાલ લેશો એવી અમો આશા રાખીએ છીએ.

છેલ્લે આ વિગતોમાં અમારી અજ્ઞાનતાદિને કારણે કોઈને પણ અન્યાય થાય તેવું કે અનુચ્ચિત યા જિનાજા વિરુદ્ધ લખાયું હોય તો તેનો ‘મિચ્છામિ ફુક્કડ’ દિયે છીએ.

૬૧૦ અમે છીએ તેઓના ઉપકારનાં ઝડુણી
શિષ્યા-પ્રશિષ્યાએ।

શ્રીહૃત્શ્રીજીનો શિષ્યા—પ્રશિષ્યાદિપરિવાર

કુંપું સ્વ. પ્રવર્તિની સાધ્વી ચન્દ્રનશ્રીજી મહારાજનાં.*
શિં પૂજય શ્રીઅશોકશ્રીજી મહારાજજી.* તેઓનાં શિં
પૂં શ્રીહૃત્શ્રીજી મહારાજ.*

ગુરુણીજી શ્રીહૃત્શ્રીજીનાં શિષ્યાએ પ્રધાનશ્રીજી
આદિ ૧૭ અને તેઓનાં પણ શિષ્યાદિ પરિવારનાં નામો
નીચેના કોણ્ટકોથી સમજવાં.

૧. સાં પ્રધાનશ્રીજી* તેઓનાં શિષ્યાએ બે,
૧. પદ્માશ્રીજી ૨. મહેદ્યાશ્રીજી તેમાં પદ્માશ્રીજીનાં
૧ પ્રજાશ્રીજી અને મહેદ્યાશ્રીજીનાં ૧ પરમપ્રલાશ્રીજી.

૨. દાનશ્રીજી શિષ્યાએ. ૧. દયાશ્રીજી. ૨. ચન્દ્રા-
શ્રીજી. તેમાં ૧. દયાશ્રીજીનાં શિષ્યાએ. ૧. દર્શનશ્રીજી,
૨. વલ્લભશ્રીજી, ૩. રાજેન્દ્રશ્રીજી. ૪. તીર્થશ્રીજી,
૫. જ્યેષ્ઠાશ્રીજી. તેમાં ૧-દર્શનશ્રીજીનાં શિષ્યાએ. ૮,
૧. વિઘુતશ્રીજી, ૨. હંસાશ્રીજી, ૩. ત્રિલોચનાશ્રીજી,
૪. રંજનશ્રીજી, ૫. કીર્તિપ્રલાશ્રીજી. ૬. જ્યોતિષપ્રલાશ્રી
૭. દીવ્યયશાશ્રી, ૮. હર્ષપૂર્ણાશ્રી. તેમાં

કું શ્રીમતી ચન્દ્રનશ્રીજીનાં ખોળાં શિષ્યા સાનશ્રીજી, ચતુર-
શ્રીજી આદિતાં. પરિવારમાં હાથ ધણાં સાધીએ છે તથા સાં
અશોકશ્રીજીનાં શિષ્યા પણ કલ્યાણશ્રીજી આદિ અન્ય સાધીએ છે.

*આ નિશાનીવાળાં કાળધર્મ પામેલાં છે એમ સમજવું.

१. વિધુતશ્રીજીનાં શિઠો સુમંગલાશ્રીજી.
૨. હંસાશ્રીજીનાં શિઠો પદ્મકીર્તિશ્રી.
૩. ત્રિલોચનાશ્રીજીનાં શિઠો ૬.૧, કનકલતાશ્રી. ૨. જ્યયકીર્તિશ્રી. ૩ લદ્રપૂર્ણાશ્રી. ૪. જ્યમાલાશ્રી. ૫. માર્ગાદ્યાશ્રી. ૬. નિત્યોદ્યાશ્રી.
૪. રંજનશ્રીજીનાં શિઠો રતિપ્રભાશ્રી, તેમનાં શિષ્યા જ્યલતાશ્રી.
૫. કીર્તિપ્રભાશ્રીજીનાં શિઠો હેમપ્રભાશ્રી, તેમનાં શિષ્યાએ ૫. ૧. પદ્મયથાશ્રી. ૨. સૂર્યમાળાશ્રી, ૩. ગુણમાળાશ્રી, ૪. સૂર્યરેખાશ્રી, ૫. જ્યરેખાશ્રી.
૬. તીર્થશ્રીજીનાં શિષ્યાએ ૩, ૧. કીર્તિલતાશ્રી, ૨. અર્ક્ષપ્રભાશ્રી, ૩. શુલોદ્યાશ્રી.

૩. સાઠ હરભશ્રીજી* શિષ્યા નથી.

૪. સાઠ સુનનદાશ્રીજી.* તેમનાં શિષ્યાએ, ૧. સુશીલાશ્રીજી* ૨. ચારિત્રશ્રીજી.
૧. સુશીલાશ્રીજીનાં શિષ્યાએ ૪, ૧. સુદર્શનાશ્રીજી,* ૨. ચન્દ્રપ્રભાશ્રીજી,* ૩. સુમતિશ્રીજી, ૪ સુરાનશ્રીજી.
તેમાં સુમતિશ્રીજીનાં શિષ્યાએ ૭, ૧. સુયથાશ્રી*, ૨. ભિત્રાશ્રી, ૩. અર્દ્ધશ્રી, ૪. ધનંજ્યાશ્રી, ૫. હંસપ્રભાશ્રી, ૬. રત્નપ્રભાશ્રી, ૭. મનોરંજનાશ્રી, તેમનાં શિષ્યા મહનસેનાશ્રી,
૨. ચારિત્રશ્રીજીનાં શિષ્યાએ ૧૦, ૧. મહિમાશ્રી, ૨. તરણશ્રી,* ૩. હીનેન્દ્રશ્રી, ૪. કલ્પતતાશ્રી, ૫. લાભિશ્રી*,

૬. શીલગુણાશ્રી, ૭. પુષ્પલતાશ્રી, ૮. હિરણ્યપ્રલાશ્રી,
૯. ચાડશીલાશ્રી, ૧૦. ચાર્દ્ધમાશ્રી તેમાં મહિમાશ્રીજીનાં
શિષ્યા રવિપ્રલાશ્રી,

૫. સા. રૈવતીશ્રીજીજીનાં* શિષ્યાએ ૧. સંજમશ્રીજી,
૨. કાન્તિશ્રીજી* તેમાં કાન્તિશ્રીજીનાં શિષ્યાએ ૧.
ભૂપેન્દ્રશ્રી, ૨. નન્દનશ્રી.

૬. સા ૧૦ હેમશ્રીજીજીનાં* શિષ્યાએ ૪, ૧. પ્રબોધશ્રીજી,
૨. મંગલશ્રીજી. ૩. ચન્દ્રોદયાશ્રીજી, ૪. પ્રવીષુશ્રી.

તેમાં ચન્દ્રોદયાશ્રીજીનાં શિષ્યાએ ૬. ૧. ઉમીદા-
શ્રી, ૨. હેમલતાશ્રી, ૩. કૌશલ્યાશ્રી, ૪. નયાનન્દશ્રી,
૫. જ્યાનન્દશ્રી, ૬. વિજયલતાશ્રી, ૭. મહાનન્દશ્રી,
૮. કૃતિસેનાશ્રી, ૯. જ્યસેનાશ્રી.

તેમાં હેમલતાશ્રીનાં શિ ૧૦ હર્ષપ્રલાશ્રી અને વિજય-
લતાશ્રીનાં શિ ૧૦ વિમળયશાશ્રી.

૭. સા ૧૦ શાન્તિશ્રીજીજીનાં શિષ્યા મંજુલાશ્રીજી*,

૮. સા ૧૦ હેમન્તશ્રીજી* શિષ્યા નથી.

૯. સા ૧૦ વસ્તનક્ષીજીનાં શિષ્યાએ ૪, ૧. વિદ્યાશ્રીજી,
૨. લક્ષ્મીશ્રી, ૩. દેવેન્દ્રશ્રીજી, ૪. સહૃદાશ્રીજી,

તેમાં દેવેન્દ્રશ્રીનાં શિ ૧૦ કુલાસશ્રી, અને તેમનાં શિ ૧૦ રલચૂ-
લાશ્રી, ૧૦. સા ૧૦ કુસુદશ્રીજીનાં શિષ્યાએ ૪, ૧. સુરેન્દ્રશ્રીજી*,
૨. ગીર્વાણશ્રીજી, ૩. કનકશ્રીજી, ૪. હેમેન્દ્રશ્રી,
તેમાં ગીર્વાણશ્રીજીનાં શિષ્યાએ ૧ ચેલણાશ્રી, ૨ લટેન્દ-

શ્રી તેમાં ચૈલણુશ્રીનાં શિઠો ૧. હિરણ્યપ્રભાશ્રી. તથા
જીતેન્દ્રશ્રીનાં શિઠો ૧. જીતસેનાશ્રી.

૧૧. સાઠ વિનયશ્રીઝ શિષ્યા નથી.

૧૨. સા. હેવશ્રીજીનાં શિષ્યાએ ૧૬,

૧. ચરણુશ્રીઝ, ૨ સુલોચનાશ્રીઝ, ૩ રમણીકશ્રી, ૪ મનો-
શ્રી, ૫. સૂર્યયશાશ્રી, ૬. વિજાનશ્રી, ૭. ચન્દ્રકળા-
શ્રી, ૮. વિનોદશ્રી, ૯. ચારુલતાશ્રી, ૧૦. કૈવલ્યશ્રી,
૧૧. ચિદાનન્દશ્રી, ૧૨. હેવાંગનાશ્રી, ૧૩. હીન્યશ્રી,
૧૪ અનુપમાશ્રી, ૧૫. રલશ્રી, ૧૬. હંસકીર્તિશ્રી,

તેમાં ૧. ચરણુશ્રીજીનાં શિષ્યાએ ૪. ૧. ભરંકરાશ્રી,
૨. પ્રિયંકરાશ્રી, ૩. જ્યપ્રભાશ્રી, ૪. રલરેખાશ્રી,

તેમાં ૧. ભરંકરાશ્રીનાં ૧, અરુણોદયાશ્રી, ૨. ગુણોદયાશ્રી
૨. પ્રિયંકરાશ્રીનાં ૬. ૧. કમલપ્રભાશ્રી. ૨. જ્યતકમીશ્રી.
૩. મૃગનયનાશ્રી, ૪. જ્યપૂર્ણાશ્રી, ૫. બિન્ડુપૂર્ણાશ્રી,
૬. શીતપૂર્ણાશ્રી.

૩. જ્યપ્રભાશ્રીનાં શિષ્યા-૧. જ્યવન્તીશ્રી, ૨. વિદુ-
ત્પ્રભાશ્રી, ૩. હર્ષકાન્તાશ્રી.

૨. સુલોચનાશ્રીનાં શિઠો ૧. મલયપ્રભાશ્રી, તેમનાં ૧.
મેરુપ્રભાશ્રી, તેમનાં ૧ મિત્રપ્રભાશ્રી

૩. રમણીકશ્રીનાં શિઠો મહનરેખાશ્રી.

૪. મનોજાશ્રીનાં શિઠો ૧. ચન્દ્રયશાશ્રી અને તેમનાં
. શિઠો વિનીતાશ્રી.

૫. સૂર્યયશાશ્વીજીનાં શિઠ૦ ૧. પૂર્ણાનન્દશ્રી,
 ૬. વિજ્ઞાનશ્રીનાં શિઠ૦ ૪. ૧. પૂર્ણલદ્રાશ્રી, ૨. સુરપ્રલાશ્રી,
 ૩. વસન્તપ્રલાશ્રી, ૪. હંદ્રુપ્રલાશ્રી.
 ૭. ચન્દ્રકળાશ્રીનાં ૨-શિષ્યા. ૧. યશોલદ્રાશ્રી, ૨.
 વિનયજાશ્રી.
 ૮. વિનોદશ્રીનાં ૧. શિઠ૦ ધન્દિરાશ્રી.
 ૧૩. દીવ્યશ્રીનાં શિઠ૦ ૧ હર્ષલતાશ્રી અને
 ૧૬. હંસકીર્તિશ્રીનાં શિઠ૦ ૧ યશાકીર્તિશ્રી.
-

૧૩. સાઠ પુઠપાશ્રીજીનાં શિષ્યાએ ૬. ૧. સુમલયાશ્રી,
 ૨. મનકશ્રી, ૩. નિરજનાશ્રી, ૪. પ્રલંજનાશ્રી, ૫.
 રનેહપ્રલાશ્રી, ૬. ચન્દ્રગુણ્યાશ્રી તેમાં

૧. સુમલયાશ્રીજીનાં શિઠ૦ ૧. સૂર્યકાન્તાશ્રી, ૨. વિચ-
 કાણ્યાશ્રી, ૩. તિલકશ્રી, ૪. મહેન્દ્રશ્રી, ૫. તારકશ્રી, ૬.
 કિરણુશ્રી, ૭. તિલોત્તમાશ્રી, ૮. હર્ષલતાશ્રી, ૯. શુલો-
 દ્યાશ્રી, ૧૦ વિપુલયશાશ્રી તેમાં

: ૧ સૂર્યકાન્તાશ્રીનાં ૧-પદ્મલતાશ્રી, ૨-યશોધરાશ્રી,
 ૩, મયણુશ્રી, ૪ વસન્તપ્રલાશ્રી, તેમાં પદ્મલતાશ્રીનાં
 ૧. નિરૂપમાશ્રી, ૨. કદ્વપલતાશ્રી, ૩. વીરલદ્રાશ્રી.

૨. વિચકાણ્યાશ્રીનાં શિઠ૦ ૧. ગુણોદ્યાશ્રી.
 ૩. તિલકશ્રીનાં ૨. ૧. તીર્થયશાશ્રી, ૨. શુલંકરાશ્રી.
 ૪. મહેન્દ્રશ્રીનાં શિઠ૦ ૧ સુજયેષાશ્રી.
 ૭. તિલોત્તમાશ્રીનાં ૧ અર્દુણોદ્યાશ્રી.

૨. અનકુશીનાં શિ. ઐ ૧. સુવેગશ્રી, ૨. કદમ્પયશાશ્રી.
 ૩. નિરંજનાશીનાં શિ. ૧. હીવ્યોદ્યાશ્રી.
 ૪. ગ્રલંજનાશીનાં શિ ૦ ૧. કનકપ્રેલાશ્રી, ૨. હેમેન્ડશ્રી,
 હેમેન્ડશીનાં ૨. ૧. આત્મપ્રેલાશ્રી, ૨. હેમપ્રેલાશ્રી.
 ૬. ચન્દ્રગુરુતાશીનાં ૧. નિત્યોદ્યાશ્રી.

૧૪. સાઠ સુભિત્રાશીળ શિષ્યા નથી.

૧૫ સાઠ કુમળાશીળ, શિષ્યા ૧. તૈલોક્યશ્રી.

૧૬ સાઠ મનોહરશીળ, શિષ્યા. ૧ ધર્મોદ્યાશ્રી.

૧૭ સાઠ જક્ષાશીળ શિષ્યા નથી.



સદ્ગુરુનાં લક્ષણો।

૧. ખાદ્ય ધન-ધાન્યાદિ અને અભ્યંતર કષાય-નોકષાયાદિ પરિશ્રહના ત્યાગી, કિપાક કુળ સરખાં સંસારનાં સુખોમાં નિઃસ્પૃહ, જ્ઞાન ધ્યાનાદિ આત્મહિતનાં કાર્યોમાં સ્પૃહાળું અને પ્રશમદૃપ અમૃતનું પાન કરનારા કરાવનારા શુરૂઆત જ જગતનો સાચો આધાર છે.
૨. શિષ્યના હિત માટે દંડાનું તાડન કરનારા પણ શુરૂ કલ્યાણ સાધક છે, કિન્તુ જે શુરૂ શિષ્યના આત્માની ચિંતા નહિ કરતાં પોતાની જીજ્હાથી શિષ્યના પગ ચાટે તો પણ શુરુના બેખાશમાં તે શત્રુ છે.
૩. જેમ કોઈ હુર્જન પોતાના શરણે આવેલાનું મસ્તક છેટે તો હૃદ-વિશ્વાસધાતી કણ્ઠો છે તેમ પોતાની નિશ્ચામાં રહેલા શિષ્યોને જે અજ્ઞાન-મોહ પ્રમાદ વિગેરે શત્રુઓથી બચાવવા માટે સારણા-વારણાદિ કરતો નથી તે શુરૂ પણ હૃદ વિશ્વાસધાતી છે.
૪. જે શુરૂ (અથવા શિષ્ય) ગંધની ઉપેક્ષા કરે છે-તેને અંગે પોતાની જવાબદારીને પૂર્ણ નથી કરતો તે દીર્ઘ સંસારી થાય છે અને જે ગંધનું પાલન કરે છે તે ત્રીજે ભવે સિદ્ધિગતિને પામે છે.
૫. જેણું સીનો સંગ ત્રિવિધ ત્રિવિધ ત્યજયો છે, જે સદા પંચાચારના પાલનમાં તત્પર છે અને જે બુક્તા લોાગી-લોાગમાં સંતુષ્ટ હોઈ જિતેન્દ્રિય છે, એવા શુરૂ

આ જગતમાં સર્વ જીવોને અસ્થયદ્વાન દેનારા-સ્થયથી સુકૃત કરનાશ છે.

૬. જે ખીજને પ્રમાદથી બચાવે છે, સ્વયં પાપ રહિત-શુદ્ધ માર્ગ ચાલે છે અને સર્વ જીવોના હિતને ઈચ્છિતો જે લભ્ય જીવોને તત્ત્વનો ઉપદેશ કરે છે, તેને જ્ઞાનીઓએ ઉત્તમ ગુરુ કહ્યો છે.
૭. જે રાજ મહારાજાઓ કે હેવેન્દ્રોથી પૂણલવા છતાં ઉત્કર્ષને ધરતો નથી તથા કોઈ નિન્દા કરે તો પણ જે દ્રેષ્ટ કરતો નથી, કિન્તુ વશ કરેલા મનથી જે ચારિત્રમાં (પોતાના સ્વરૂપમાં) રમે છે તેવો ગુરુ રાગ-દ્રેષ્ટનો નાશ કરે છે—કરાવે છે.
૮. જે જિનાગમના રહસ્યને જાળે છે, ઉત્સર્ગ-અપવાદની મયોદ્ધા સમજે છે, અને વિના કારણે અપવાદનો આશ્રય કરતો નથી, તે શુદ્ધ પુરુષાર્થકારી અશાઠ-ચારિત્રી સર્વત્ર જૈનશાસનની પ્રભાવના કરે છે.
૯. ઉત્તમ શિષ્યને ધ્યાન કરવા યોગ્ય કોઈ હોય તો ગુરુની મૂર્તિ-આકૃતિ છે, સેવા કરવા યોગ્ય ગુરુના ચરણો છે, મહામંત્ર તુલ્ય ગુરુનું વાક્ય છે, અને મોક્ષપ્રાપ્તિ માટે જરૂરી એક જ ગુરુ કૃપા છે. અર્થાત્ ઉત્તમ ગુરુની આકૃતિનું ધ્યાન કરવાથી, તેના ચરણુની સેવા કરવાથી અને એના વચનને મન્ત્ર તુલ્ય માની પાલન કરવાથી શિષ્ય ગુરુની કૃપાને મેળવી શકે છે. અને ગુરુકૃપાને બણે સંસારમાંથી પોતાનો નિસ્તાર કરી શકે છે.

શિષ્યનાં લક્ષ્ણો।

૧. શુરૂ પોતાની સારણુ-વારણુહિ કરે એવું જે ઈચ્છે નહિ અને સારણુહિ કરતાં જે કોણ કરે, તે ફુલ શિષ્ય ઉપદેશને પણ લાયક નથી તો શિષ્યપણું તો તેમાં આવે જ કયાંથી ?
૨. પોતાની ઈચ્છા પ્રમાણે જય, ઈચ્છા પ્રમાણે આવે, ઈચ્છા પ્રમાણે વતો, એમ શુરૂની આજાની અપેક્ષા ન રાખે તેવા કુશિષ્યને ઉત્તમ શુરૂઆત (તેને વધુ કર્મનો બંધ ન થાય એવી કરણું દિશ્થી) છાડી હેવો જેઠાં.
૩. શુરૂઆજામાં રહેનારો, પોતાના જીવનની જવાખદારી શુરૂને સોંપી નિશ્ચિત આનંદ અનુભવનારો શિષ્ય સમ્યગ્ શાનને પામી શકે છે અને સમ્યગ્ દર્શાન તથા ચારિત્રમાં અત્યંત સ્થિર બને છે. હેવો પણ તેને ચલાયમાન કરી શકતા નથી, માટે ધન્ય પુરુષો જીવતાં સુધી શુરૂની નિશ્ચાને તજતા નથી.
૪. હિતકારી વચન પ્રાયઃ કડવું હોય છે, તેથી તે ઔષધની જેમ કડવું લાગવા છતાં આત્માના અનાદિ રોગોનો નાશ કરે છે.
૫. શુરૂનું વચન (અનાદિ મોહની વાસનાવાળા) શિષ્યને પ્રારંભમાં ભરસાડના અગ્નિની જેમ (સંતાપ) તાપ કરે છે, પણ પરિણ્યામે કર્મણના દંડના સ્પર્શની જેમ તે શીતલતા ઉપણવે છે.

૬. ઉત્તમ શિષ્યો ગુરુની સેવા એવા પ્રસન્ન ચિંતે કરે છે કે પંથક સાધુની જેમ ગુરુને પણ તે સંસારથી પાર ઉતારે છે.
૭. ગુરુની સાથે રહેવા છતાં જે ગુરુથી પ્રતિકૂળ વર્તન કરે છે, તેઓનો ગુરુકુળવાસ નિઃકૂળ છે, અથવા ઉલટો સંસાર વર્ધક-હાનિ કારક છે.
૮. માટે મોાક્ષાર્થી સાધુ ગુરુની સેવાને મોાક્ષનું પ્રથમ અંગ (પ્રથમ કારણ) માનતો ગુરુની ઈચ્છાને વશ ખની જાય છે અને થાડી પણ મન-વચન-કાયાથી ભૂત થાય તો નિઃકષ્ટ ભાવે ગુરુને તે જણાવી પ્રાય-શ્રિત કરે છે.
૯. જે પોતાના પરિણામોને વારવાર ગુરુની આગળ જણાવે છે, જે ગુરુના હૃદયના ભાવને ઈગિત આકારથી જરૂરી તે પ્રમાણે વર્તે છે, અને જે સુજિત્ત માટે સતત પ્રયત્નશીલ (અપ્રમત્ત) રહે છે, તેને સાચો શિષ્ય કહેલો છે.
૧૦. છઠુ, અઠુમ, ચાર, પાંચ ઉપવાસ કે માસક્ષમણું વિગેરે અતિ આકરાં તપ કરવા છતાં ગુરુ આજાને વિરાધે છે તે અનંત સંસારી થાય છે.
૧૧. સર્વ કિયાએ કરનારો અને ગુણવાનોમાં અગ્રેસર પણ શિષ્ય ગુરુઆજાની આરાધના વિના સિદ્ધિ પામતો નથી.
૧૨. ગુરુના મુખમાંથી નીકળતા શફ્ફો સર્વપાપના પ્રાય-શ્રિતરૂપ બને છે, કોઈપણ ભીજુ કિયા નહિ કરનારો છતાં ગુરુ વચનને અનુસરનારો સર્વ કર્મથી મુક્ત થાય છે, પણ જે ગુરુની આજાનું ઉલ્લંઘન કરે છે તેની કોઈ (જિનાજાને અનુસરતી) કિયા પણ સફૂળ થતી નથી.

ગુરુગુણ ગીત.

ધન્ય ધન્ય તે શુરૂ જે નિજમાં રહે,
 ખરતા નિજગુણ રાગરે;
 હરતાં પાપો જે ભવિળવનાં,
 કરતાં પરલય ત્યાગરે—ધન્ય ધન્ય૦ (૧)

સમ સુખ હુઃખને રે જે ગણુતાં સદા,
 નહિ નિજ પરનો કોદ રે;
 તો પણ નિજને રે જે નવિ ભૂલતાં,
 અદ્ભૂત એહ વિવેક રે—ધન્ય ધન્ય૦ (૨)

શાન ચક્ષુથી જગ અવલોકતાં,
 પર હૃષણુ પ્રતિ અંધરે;
 મૂડ રહે જે વિકથા વાદમાં,
 ધરતાં શીલ સુગંધરે—ધન્ય ધન્ય૦ (૩)

રતનત્રયીધર નવિ કિંચન ધરે,
 કદી ન કોપે જેહ રે;
 આપે જગને રે જે નિજ સંગથી,
 દેતાં મોહને છેહ રે—ધન્ય ધન્ય૦ (૪)

શરણ થને એ શુરૂનું સર્વદા,
 જેહથી લવહુઃખ જાય રે;
 આવે નિજ ધરમાં સૈવક સદા,
 હીર તુલ્ય શ્રી થાય રે—ધન્ય ધન્ય૦ (૫)



“ ध्यानमूलं गुरोर्मूर्तिः
पूजामूलं गुरोः पदम् ।
मन्त्रमूलं गुरोर्वाक्यं,
मोक्षमूलं गुरोः कृपा ॥ ”